



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

વેબસાઈટ :- www.egovamc.com

એસેસમેન્ટ એન્ડ ટેક્સ કલેક્શન ખાતુ (મધ્યઝોન)


માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫

અંતર્ગત કલમ ૪ (૧) બી (૧) મુજબ

ખાતાનુ પ્રો - એક્ટિવ ડીસ્ક્લોઝર

અદ્યતન કર્યાની તારીખ- ૧૯/૧૧/૨૦૨૨

(૧) વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો:
(અ) વ્યવસ્થાતંત્ર



પ્રથમ અપીલ અધિકારી અને
ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર



જાહેર માહિતી અધિકારી અને
આસી.મેનેજર (પ્રોપર્ટી) ટેક્ષ



ડીવીઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ (જે-તે બીટ)

ખાડીયા રાયખડ કાળુપુર શાહપુર માધુપુરા શાહીબાગ અસારવા

(બ) કાર્યો અને ફરજો :-

એસેસમેન્ટ એન્ડ ટેક્સ કલેક્શન ખાતા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલ તમામ મિલકતો ઉપર મિલકતવેરો ઉધરાવવાની કામગીરી કરવામાં આવે છે. મિલકતોમાં રહેઠાણ તથા બિનરહેઠાણ મિલકતોનો સમાવેશ થાય છે, જે સાથે જ ભાડુઆત તાબે કે માલિક તાબે મિલકતો વપરાશમાં હોય છે. આ ખાતા દ્વારા ટેક્સની વસુલાત માટે દરેક પ્રોપર્ટીનું એસેસમેન્ટ કરવું જરૂરી હોય છે.

કરદાતાઓ તરફથી આવતી નીચે મુજબની અરજીઓનો નિકાલ ટેકસ ખાતા દ્વારા કરવામાં આવે છે.

- મિલકતની માલિકીના નામ ટ્રાન્સફર અને મિલકતના કબજેદારના નામમાં ફેરફાર કરવા.
- બી.પી.એમ.સી. એક્ટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરકયુલર નં.૧૪ મુજબ વપરાશના પ્રકારના ધોરણે મિલકતની આકારણી ઘટાડવા અંગે
- એકજ મિલકતના બે બિલ આવતા હોય તો વધારાના બિલ રદ કરવા અથવા સમગ્ર મિલકતનું એક બિલ આવતું હોય તો વપરાશના ધોરણે જુદા જુદા બિલ કરવા અંગે
- મિલકત ખાલી/બીનવપરાશ અંગે નોંધ રાખી ખાલી મિલકતનો ટેકસ રીફંડ મેળવવા.
- નવી મિલકતનું એસેસમેન્ટ કે જૂની મિલકતોનો વપરાશ બદલાયો હોય, ભાડાના દરમાં ફેરફાર થયો હોય તો આકારણી રીવાઈઝ કરવા અંગે
- મ્યુનિસિપલ વેલ્યુએશન અપીલના ચુકાદાનો અમલ આપવો.
- ચર્તુવર્ષિય આકારણીના વર્ષે જાહેરનામાની મુદતમાં વાંધા અરજીઓ સ્વીકારી એપેલેટ ખાતા દ્વારા તેનો પુરાવાના આધારે, સ્થળ તપાસ કરી નિકાલ કરવામાં આવે છે.

● નવી મિલકતોની આકારણી અથવા આકારણી રીવાઈઝ કરવા માટે

નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગર ભાડુઆતના ધોરણે વપરાશ કરવામાં આવતો હોય તેમજ વપરાશમાં ફેરફાર થયેલ હોય તો આકારણી રીવાઈઝ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કરેલ ફોર્મમાં અરજી સાથે

(૧) રહેઠાણ માટે મિલકતના માલિકીના પુરાવાની પ્રમાણિત નકલ, જમીન માલિકીનો ૭/૧૨ નો ઉતારો, ઓર્ગેનાઈઝર પાસેથી કબજો મેળવ્યો હોય તો તેની કબજા પહોંચની પ્રમાણિત નકલ, રેશનકાર્ડ, ગેસ કનેક્શનના પુરાવા તથા

(૨) બીનરહેઠાણ માટે ગુમાસ્તાધારાનું લાઈસન્સ, સેલ્સ ટેક્સ રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ, વીજળીનું બીલ, ટેલિફોનનું બિલ રજૂ કરવા.

જમીનદોસ્ત થયેલ મિલકતના ટેકસના બિલો રદ કરાવવા માટે

જૂની મિલકત જમીનદોસ્ત ક્યારે થઈ તેના પુરાવા, જૂની મિલકત તોડી પાડ્યા અંગેની અરજી આપેલ હોય તેની પહોંચની ઝેરોક્ષ, નવી મિલકત બાંધવા અંગે પ્લાનની વિગત, બી.યુ.પરમીશન ક્યારે આપવામાં આવી છે તેની વિગત, નવી મિલકતની આકારણી ટેક્સ ખાતા દ્વારા કયા વર્ષથી કરવામાં આવી છે તેની વિગત, રદ કરવાના બિલોની ઝેરોક્ષ નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.

સમગ્ર સમગ્ર મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે

સમગ્ર મિલકતનું એક બિલ આવતું હોય તેના બદલે જગાના વપરાશ મુજબ મિલકતના ભાગલા પાડીને તે મુજબ ટેક્સના બિલ મેળવવા માટે, અરજી ફોર્મ સાથે બિલની પ્રમાણિત નકલ, ભાડુઆત તાબે મિલકતના ભાડાના પુરાવામાં ભાડા કરારની પ્રમાણિત નકલ રજૂ કરવી.

● મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે

અરજી ફોર્મ સાથે જૂના ભાડુઆત મિલકત ખાલી કરી ગયાનો પુરાવો / કબજો સોંપ્યાનો પત્ર /કબજા કરારની નકલ, નવા ભાડુઆતનો ભાડા કરાર, ભાડુઆત ખાલી કરી ગયા હોય તો તે અંગે અ.મ્યુ.કોર્પો. ને જાણ કર્યા અંગે અગાઉ અરજી કરેલ હોય તો અરજી કાર્ડની નકલ, પ્રોપર્ટી ટેક્સના છેલ્લા બિલની નકલ સામેલ રાખી નિયત ફોર્મમાં અરજી કરવાની છે.

- મિલકત ખાલી / બીનવપરાશ (નોન યુઝ) અંગેની નોંધ રાખવા માટે:

જે તે નાણાંકિય વર્ષમાં અરજી સાથે પ્રોપર્ટી ટેક્સના બિલની નકલ રજૂ કરવાથી, જે તે નાણાંકિય વર્ષમાં મિલકત ૩૦ દિવસ કરતાં ઓછા સમય માટે ખાલી હશે તો મિલકતવેરાની રકમ મજરે મળી શકશે નહિ. જે દિવસે અરજી આપવામાં આવી હશે તે તારીખથી ખાલીનો લાભ મળી શકશે. દરેક નાણાંકિય વર્ષમાં મિલકત ખાલી રહેવાની હોય તો અગાઉથી અરજી કરવાની છે. વર્ષના અંતે ખાલીનો લાભ આપવામાં આવે છે.

- મ્યુનિસિપલ વેલ્યુએશન અપીલના ચુકાદાનો અમલ કરવા માટે

મ્યુનિસિપલ વેલ્યુએશન અપીલના ચુકાદાની પ્રમાણિત નકલ રજૂ કરવી. છેલ્લા બિલની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.

-એક જ મિલકતના બે બિલ આવતાં હોય તો વધારાનું બિલ રદ કરવા બાબત.

અરજી સાથે ચાલુ બિલ તથા રદ કરવાના બિલની પ્રમાણિત નકલ સામેલ કરી નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.

- બી.પી.એમ.સી. એક્ટની કલમ ૪૮૫/૧,૩૯-૨૦ તથા સરકયુલર નં.૧૪ મુજબ મિલકતની આકારણી ઘટાડવા માટે

નવી ફોર્મ્યુલા અમલમાં આવ્યા બાદ નીચેનામાંથી કોઈપણ ફેક્ટરમાં ફેરફાર થાય તો ૪૮૫/૧ મુજબ મ્યુ.કોર્પોરેશનને અરજી કરવાથી ટેક્સમાં ફેરફાર કરી આપવામાં આવે છે.

કારપેટ એરીયા: કોઈપણ મિલકતમાં કારપેટ એરીયામાં ફેરફાર હોય તો તે અંગે નિયત ફોર્મમાં અરજી કરવાથી સ્થળ તપાસના આધારે ફેરફાર કરી આપવામાં આવશે.

ફેક્ટર-૨ મિલકતના બાંધકામના વર્ષમાં ફેરફાર હોય તો ટેક્સમાં ફેરફાર થાય. અરજીનાર બાંધકામ વર્ષના પુરાવા સાથે અરજી આપે તો સ્થળ તપાસ કરી ટેક્સ ઘટાડી આપવામાં આવશે .

ફેક્ટર-૩ મિલકતના ઉપયોગ આધારિત ફેરફાર થાય તો જરૂરી પુરાવા રજૂ કરેથી અરજી કરવાથી ટેક્સ ઘટાડી આપવામાં આવે છે.

ફેક્ટર-૪ માલિકી સંબંધિત ફેક્ટરમાં એટલે કે ભાડવાતમાંથી માલિક થતા હોય પુરાવા સાથે અરજી કરવાથી તે મુજબ ફેક્ટરમાં ફેરફાર કરી આપવામાં આવે છે.

- મિલકતના નામ ટ્રાન્સફર માટે

અરજી સાથે નામ ટ્રાન્સફર કરવા માટે સિટી સર્વેની પ્રમાણિત નકલ, જો મિલકત રજીસ્ટર્ડ કો.ઓ.હા.સોસાયટીમાં હોય તો પઝેશન લેટર અને શેર ટ્રાન્સફરના ઠરાવની ચેરમેન અથવા સેક્રટરીની સહી સિકકાવાળી પ્રમાણિત નકલ, અથવા રજીસ્ટર્ડ દસ્તાવેજ અથવા ઈન્ડેક્સની નકલ., અથવા કન્વેયન્સ ડીડની પ્રમાણિત નકલ જેના નામે મિલકત ટ્રાન્સફર કરવાની છે તેઓની અરજી ફોર્મના કોલમ નં.૯ માં મિલકત ખરીદનાર બધાની સહી કરાવવી રજૂ કરવાથી કરી આપવામાં આવશે. આ મિલકતનો અરજી કર્યા તારીખ સુધીનો પૂરેપૂરો તમામ ટેક્સ ભરી પહોંચની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની છે.

ક્રમાંક નં. ૨ થી ૧૦ ના દરેક ફોર્મની કિંમત રૂા.૨-૦૦ રાખવામાં આવેલ છે.

જાહેરનામાના અનુસંધાનમાં મ્યુનિસિપલ મિલકતવેરાના આકારણી અંગે વાંધા અરજી કરવા માટે

દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સના બિલ ઈસ્યુ કરતા પહેલા જાહેરજનતા પોતાની મિલકતનો ટેક્સ કેટલો છે તે જાણી શકે તે માટે ૧૫ દિવસ સુધી એસેસમેન્ટ રજીસ્ટરો જોવા માટેની જાહેરાત બે વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે. નાગરિકો વિનામૂલ્યે આવી નોંધ જોઈ શકે છે, તેનો ઉતારો કરી શકે છે અને નોંધ કે ટેક્સ સામે કોઈ વાંધો હોય તો પુરાવા સાથે નિયત ફોર્મમાં નિયત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. વાંધા અરજીના નિકાલ માટે એપેલેટ ઓફિસર ઉપરોક્ત અરજીની સુનાવણી કરી નિકાલ કરશે. એપેલેટ ઓફિસરના હુકમથી સંતોષ ન હોય તો આવો હુકમ મળ્યાના ૧૫ દિવસની અંદર સ્મોલ કોઝ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. બિલ સામે ફરિયાદ કરી શકાતી નથી.

ખાસ નોટિસ સામેની વાંધા અરજી અંગે

હયાત મિલકતમાં કોઈ વધારાના બાંધકામના સમયે કે મિલકતનો વપરાશ માલિક તાબેથી ભાડુઆત તાબે થાય કે રહેઠાણમાંથી બીનરહેઠાણમાં વપરાશ બીલ આવવાના લીધે ચાલતો ટેક્સ વધારવાના સમયે કારણોની વિગત સાથે મિલકત ધારકને ખાસ નોટીસ આપવામાં આવે છે. સદરહુ નોટિસ મળ્યાના ૧૫ દિવસમાં વાંધાના કારણો-પૂરાવા સાથે વાંધા અરજી કરી શકાય અને અને આવી વાંધા અરજીનો નિકાલ જાહેરનામાના સંદર્ભમાં કરવામાં આવેલ વાંધા અરજીના નિકાલની જેમજ એપેલેટ ઓફિસર દ્વારા કરવામાં આવે છે.

મિલકત વપરાશ / પુનઃ વપરાશ સમયે કરવાની ફરજિયાત જાણ:

કોઈપણ નવી મિલકત કે જૂની બંધ મિલકતનો પુનઃ વપરાશ શરૂ કર્યાના ૧૫ દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી.પી.એમ.સી. એક્ટના પરિશિષ્ટ એ ના પ્રકરણ-૮ ના રૂલ ૫ હેઠળ જાણ કરવી ફરજિયાત છે. નિયત કરવામાં આવેલ રીકવીઝીશન ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ક્યેરીઓના ટેક્સ વિભાગમાંથી વિના મૂલ્યે મળી શકશે. સમયમર્યાદામાં મિલકતના વપરાશ કે મિલકતમાં થયેલ વધારાના બાંધકામ, બદલાયેલ ઉપયોગના પ્રકાર કે ભાડુઆત અંગે જાણ કરવામાં ન આવે તો આવી મિલકતોનો ટેક્સ આકારણી/પુનઃ આકારણી , ટેક્સ ખાતા દ્વારા પુરાવાના અભાવે કરવામાં આવે છે.

● અરજી નિકાલની સમય મર્યાદા

તમામ પૂરાવાઓ અરજી સાથે આપેલા હોય અને નવી ગણતરી મુજબ પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કરવામાં આવેલ હોય તો અરજીનો નીચે જણાવેલ સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવશે.

અનુ. નંબર	અરજીનો પ્રકાર	અરજીના નિકાલની સમય મર્યાદા
૧	બી.પી.એમ.સી. એક્ટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરકયુલર નં. ૧૪ મુજબ મિલકતની આકારણી ધટાડવા બાબત	૧ માસ
૨	નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગર તો જૂની મિલકત ભાડુઆત પાસેથી કરવામાં આવેલ ભાડાના વધારાને લઈ તેમજ વપરાશ ફેરફાર થયેલ હોઈ આકારણી રીવાઈઝ કરવા	૧ માસ
૩	મિલકતના કબ્જેદારમાં ફેરફાર કરવા બાબત	૧૫ દિવસ
૪	મિલકતના ઉપયોગના પ્રકારમાં ફેરફાર	૧ માસ
૫	જમીનદોસ્ત થયેલ મિલકતના ટેક્સના બિલો રદ કરવા	૧ માસ
૬	સમગ્ર મિલકતનું એક બિલ આવે છે તેના બીલે જગાના વપરાશ મુજબ આકારણીના ભાગલા પાડીને તે મુજબ ટેક્સ બિલ આપવા બાબત	૧ માસ
૭	એક જ મિલકતના બે બિલ આવતા હોય તો વધારાનું બિલ રદ કરવા	૧ માસ
૮	મિલકતના નામ ટ્રાન્સફર માટે	૧૫ દિવસ
૯	અન્ય-સામાન્ય અરજીઓ	૧૫ દિવસ
૧૦	મિલકત ખાલી / નોન યુઝ અંગે	વર્ષ પુરું થયા બાદ ૩૦ એપ્રિલ સુધી
૧૧	મ્યુ. વેલ્યુએશન અપીલના ચુકાદાનો અમલ લેવા અંગે	૧૫ દિવસ


ઉપરોક્ત પ્રકારની અરજીઓના નિકાલ માટેની લઘુત્તમ સમય મર્યાદા ખાતા દ્વારા નિયત કરવામાં આવેલ છે. જો ઉપરોક્ત સમય મર્યાદામાં અરજીનો નિકાલ ન થાય તો સંબંધિત ઝોનનાં ડેપ્યુટી એસેસર ઍન્ડ ટેક્સ કલેક્ટરનો રૂબરૂ સંપર્ક કમકાજના દિવસોએ ૩-૦૦ થી ૫-૦૦ માં કરવો.

બિલમાં નામ/ સરનામાં (સ્પેલીંગ) અંગેની ભૂલ માટે પૂરાવા સાથે સાદા કાગળ ઉપર અરજી કરવાથી તે અંગેનો નિકાલ કરવામાં આવશે.

આવી અરજીઓ કરવા જાહેર જનતાની અનુકૂળતા માટે ખુબજ નજીવી કિંમતે છાપેલા ફોર્મ દફતર વિભાગ તથા દરેક ઝોન તથા દરેક સીવીક સેન્ટર ઉપરથી નાગરિકોને ઓફિસ સમયે વેચાણ આપવામાં આવે છે. તેમજ ભરેલ ફોર્મ કોઈપણ ઝોનની અરજી આપી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે. નીચે મુજબના કેશ કલેક્શન કાઉન્ટરો રાખવામાં આવેલ છે.

બિલ મળ્યાના ૧૫ દિવસમાં જો બિલ ભરવામાં ન આવે તો ટેક્સ બીલમાં જણાવેલ રકમ તેમજ પાછલા વર્ષની બાકી રકમ નિયમ મુજબ કાયદાકીય જરૂરી પગલાં લઈ દંડ સાથે વસુલ કરવામાં આવે છે.

(૨) અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો:-



(૩)

ફરીર- ગુજરાત કાઉન્સિલ

ઈ-સ્પેક્ટર (એસેસમેન્ટ, રીકવરી તથા એડમી.) ની કામગીરી (સીનીયર ક્લાર્ક)

૧. રીકવરી:

પ્રોપર્ટી ટેક્સની રીકવરી અંગે તબક્કાવાર કામગીરી હાથ ધરવાની છે.

- ૧.૧. બીલોની ચકાસણી કરવી, તેને લગતી ફરીયાદોનો નિકાલ કરવો.
- ૧.૨. વાંધા અરજીવાળા બિલો અલગ કાઢી લેવા
- ૧.૩. વાંધા અરજી સિવાયના બીલો ઉપર જરૂરી સિક્કા લગાવવા.
- ૧.૪. વાંધા અરજી સિવાયના બીલો નિયત સમય મર્યાદામાં જે તે કરદાતાને મળે તે રીતે પહોંચાડવા.
- ૧.૫. બીલના નાણાં ભરવાની છેલ્લી તારીખ પસાર થયા પછી બાકી પત્રક તૈયાર કરવા.
- ૧.૬. બીલ ઈસ્યુ થયા બાદ કરદાતા દ્વારા રહે મેળવવામાં આવ્યો હોય તો તેની ડીમાન્ડ રજીસ્ટરે નોંધ કરવી અને રીકવરી સ્ટાફને તેની જાણ કરવી.
- ૧.૭. પાર્ટ પેમેન્ટ માટે જ્યારે કરદાતા નાણાં ભરવા આવે ત્યારે પાર્ટ પેમેન્ટ અંગેની ખાતાએ નિયત કરેલ ફોર્મમાં સ્વીકૃતિ બનાવી આપવી.
- ૧.૮. પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હોય તેવા કરદાતા સામે રીકવરીના કડક પગલાં રૂપે છેલ્લી ચેતવણીના કાર્ડ લખવા, પાણીના કનેક્શન કાપવા, વોરંટ તૈયાર કરવા તથા તેને ભજવવાની કામગીરી કરવી.
- ૧.૯. વોરંટ ઈસ્યુ કર્યા બાદ જે કરદાતા પ્રોપર્ટી ટેક્સ ન ભરે તો તેની મિલકતની હરાજની કાર્યવાહી કરવાની થાય છે તે અંગે હરાજ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હરાજથી સેલ કન્ફર્મ સુધીની કાર્યવાહી કરવાની.
- ૧.૧૦. વોર્ડની રીકવરીના ચેક સ્વીકારાયા વગર પરત આવે તેવા રીટર્ન ચેકની રીકવરીની કામગીરી તાકિદે કરવી અને જે રીટર્ન ચેકની રીકવરી આવે તેમ ન હોય તો ડીમાન્ડે વધ કરવાની જરૂરી મંજૂરી મેળવવા તથા તે અંગે મંજૂરી મળ્યે ડીમાન્ડે નોંધ રાખવી અને તે સુજબનું કમ્પ્યુટર ફોર્મ ભરી કમ્પ્યુટર ખાતે મોકલાવી આપવું.
- ૧.૧૧. કરદાતાઓ તરફથી કર ભરવા અંગે માંગવામાં આવેલ હપ્તાની અરજી અંગે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી આપેલ હપ્તા મુજબ સમયસર નાણાં વસુલ કરવા.
- ૧.૧૨. રીકવરી માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ડી.સુ.શ્રી સાથે તથા ઉપરી અધિકારી સાથે જે તે મિલકતની રીકવરી માટે વોર્કમાં જવું.

૨. એસેસમેન્ટ:

- ટી.ડી.ઓ. ખાતેથી આવેલ બી.યુ.પરમીશનના આધારે, વિજિલન્સ રીપોર્ટના આધારે, ટેક્સ જનરલની અરજીના આધારે, ભાડાફોડ કરવા અંગે, સ્થળ તપાસ દરમિયાન આકારણી કરવા યોગ્ય મિલકતની આકારણી અંગે, વેલ્યુએશન તથા એપેલેટ ઓફિસરની રીમાર્ક્સના અનુસંધાને વિ. અંગે જે મિલકતોની નવેસરથી આકારણી કરવાની થાય તેમાં તેમજ ચાલુ મિલકતોની આકારણી વધારવા અંગેનીયે મુજબની કાર્યવાહી કરવાની છે.
- ૨.૧ જે તે મિલકતની જગા ડી.સુ. ને બતાવવી તથા ડીસુ.ની સુચના મુજબ જગાના માપ લેવા.
 - ૨.૨ જે તે મિલકતના રેકવીઝિશન ફોર્મ તૈયાર કરી મકાન માલિક અગર કબજેદારને તેઓને મલ્યાની સહી લઈ આપવી.
 - ૨.૩ નિયત સમય મર્યાદામાં રેકવીઝિશન ફોર્મ પરત આવે જરૂરી પુરાવા સાથે ફાઈલ તૈયાર કરી ડી.સુ.ને આકારણીની કાર્યવાહી કરવા સોંપવી.

newstaff

(5)

(24)

૨.૪ ડી.સુ. મારફતે કરવામાં આવેલ આકારણી અંગેની ખાસ નોટિસો તેમજ ચતુર્વર્ષિય આકારણી દરમ્યાન વેલ્યુએશન ઓફિસરો મારફતે આકારણીમાં કરવામાં આવેલ વાધારા અંગેની જે ખાસ નોટિસો આવે તે ચેક કરી જે તે કરદાતાને પહોંચતી કરવી અને તે મદ્યા અંગેની સહી લેવી.

૩. **વહીવટ:**

૩.૧ આકારણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા પહેલાં એસેસમેન્ટ રજીસ્ટરની ડીમાન્ડ રજીસ્ટર સાથે મેળવવું અને ડીમાન્ડ રજીસ્ટર મુજબના આકારણી અંગેના તમામ છેલ્લામાં છેલ્લા સુધારા નોંધી એસેસમેન્ટ બુક તૈયાર કરવી.

૩.૨ વેલ્યુએશન વર્ષમાં વેલ્યુએશન ખાતે રફ રજીસ્ટર મોકલતા પહેલા તમામ સુધારા રફ રજીસ્ટરમાં મૂકી જે તે રફ રજીસ્ટરો વેલ્યુએશન ખાતે પૂરા પાડવા.

૩.૩ જાહેરનામા દરમ્યાન આવેલ કરદાતાને તેની મિલકત અંગેની તેને જોઈતી માહિતિ એસેસમેન્ટ જોઈ પૂરી પાડવી અને જરૂર પડે તેને ઉતારો કરવા દેવો.

૩.૪ જાહેરનામાની મુદત દરમ્યાન અગર ખાસ નોટિસના અનુસંધાનમાં આવેલ વાંધા અરજીઓના દાખલા ભરી ટપાલબુંડે ચઢાવી એપેલેટ ખાતે સમયસર મોકલી આપવા.

૩.૫ વાંધા અરજીઓનો નિકાલ યઈ એપેલેટ ખાતેથી આવેલ હ.ર.કરાવ મુજબ ડીમાન્ડ રજીસ્ટરમાં અગર ભાડાપત્રકે જરૂરી નોંધ રાખવી અને કરદાતાને સુધારેલું ટેક્સનું બીલ બજાવવું તેમજ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સુધારા અંગેના કોમ્પ્યુટર ફોર્મ ભરવા અને કોમ્પ્યુટર ખાતે મોકલી આપવા.

૩.૬ કોમ્પ્યુટર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીમાન્ડ રજીસ્ટરો બંધાવી તેને પાછલા વર્ષના ડીમાન્ડ સાથે મેળવણી કરી, પાછલા વર્ષના ડીમાન્ડના તમામ સુધારા આવ્યા છે કે કેમ? તે ચેક કરવા અને જે સુધારા ન આવ્યા હોય તેના સુધારા મૂકી નવેસરથી કોમ્પ્યુટર ફોર્મ ભરવા અને તે મુજબનું સુધારેલું બીલ કરદાતાને મોકલવું.

૩.૭ વેલ્યુએશન વર્ષ દરમ્યાન વેલ્યુએશન ઓફિસરશ્રીએ જે નવી વધ કરી હોય તેવી વધના નવા ટેનામેન્ટ નંબરનું કોમ્પ્યુટર કોર્ડિંગ કરવું અને કોર્ડિંગ કરેલા રજીસ્ટરો કમ્પ્યુટર ખાતે મોકલવા.

૩.૮ પ્રોપર્ટી ટેક્સ સંબંધમાં આવતી વિવિધ અરજીઓનો નીચે જણાવ્યા મુજબ નિકાલ કરવો.

૩.૮.૧ નામ ટ્રાન્સફર: (ટેક્સ ટી.એસ.એફ.) ની અરજી અંગે જરૂરી મંજૂરી મેળવવા માટે ફાઈલ તૈયાર કરી યોગ્ય સત્તાની મંજૂરી મેળવવી.

૩.૮.૨ ટેક્સ વેકન્ટ: (ખાલી અંગેની અરજી): આ અંગેની અરજીઓમાં દર માસે સ્થળ તપાસ કરી જે તે મિલકત પરેખર ખાલી હોવા અંગે ખાત્રી કરવી. તેમજ માર્ચ માસમાં ૧૦૦૦ થી ૩૦૦૦ સુધીની આકારણીવાળી મિલકત ડી.સુ.શ્રીને તેમજ રૂ.૩૦૦૦ થી ઉપરની આકારણીવાળી મિલકત આસિ.મેનેજર અગર ડે.એસેસર અને કલેક્ટરશ્રીને બતાવવી અને જે મિલકતમાં ખાલીનું રીફંડ મલતું હોય તેવી મિલકતો માટે જરૂરી મંજૂરી માંગી, રીફંડની ગણતરી કરાવી, ડીમાન્ડ નોંધ મુકવી અને કોમ્પ્યુટર ફોર્મ ભરવા.

૩.૮.૩ વાંધા અરજી: પ્રોપર્ટી ટેક્સની આકારણી અંગે આવેલ વાંધા અરજીઓના દાખલા ફોર્મ ભરી ડી.સુ. મારફતે એપેલેટ ખાતે મોકલવી.

૩.૮.૪ ટેક્સ એન.ડબલ્યુ.સી.આર. (નવા વોટર કનેક્શનની અરજી અંગે) જે તે મિલકતમાં પાણીનું નવું કનેક્શન લેવા માટે પાણી ખાતાનું જે ફોર્મ ભરવામાં આવે છે તે ફોર્મમાં વોર્ડ, સર્વે નંબર, સેન્સસ નંબર, માલિકનું નામ વિગેરે ડીમાન્ડ સાથે ચકાસી, આ મિલકતનો પૂરેપૂરો ટેક્સ વસુલ છે કે કેમ તે અંગેનું સર્ટિફિકેટ આપવું.

newstaff

(6)

(7)

૩.૮.૫ ટેક્સ જનરલ: ટેક્સ જનરલની આવેલઅરજીઓ અંગે ડીમાન્ડ દાખલા ભરવા અને આવી અરજી અંગે યોગ્ય સત્તાની મંજૂરી મલ્યેથી અરજદારને જવક મોકલવો.

૩.૮.૬ કોર્ટ મેટર તથા વેલ્યુએશન અપીલ તેમજ તેના જજમેન્ટના અમલ આપવાની કાર્યવાહી: કોર્ટ તરફથી આવેલ સમન્સ મુજબની તેમજ મ્યુનિ. વેલ્યુએશન અપીલોમાં મ્યુ.એડવોકેટ દ્વારા માંગવામાં આવેલ માહિતી જરૂરી વિગતો સાથે તાકિદે તૈયાર કરાવી અને તે મ્યુ.એડવોકેટશ્રીને પહોંચાડવાની કામગીરી કરવી અને જરૂર પડે કોર્ટમાં હાજર રહેવું. કરદાતા તરફથી આકારણી અંગે સ્મોલ કોઝ કોર્ટમાં દાખલ થયેલ વેલ્યુએશન અપીલ અંગે મ્યુ.એડવોકેટશ્રીને ડીમાન્ડ દાખલાના ફોર્મ ભરી વે.ઓ.ના તથા એપેલેટ ઓફિસરના ઠરાવની નકલ તેમજ મ્યુ.એડવોકેટશ્રીને જે કોઈ માહિતીની જરૂર હોય તે પૂરી પાડવી. આકારણી અંગેના સ્મોલ કોઝ કોર્ટના ચુકાદાનો અમલ આપવાની કામગીરી કરવી. આ કામગીરી કરતી વખતે જે કેસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને આર્થિક રીતે નુકશાની ભોગવવી પડે તેમ હોય તેવા કેસોમાં તેવા જજમેન્ટો ઉપલી અધિકારીના ધ્યાન પર લાવી, જરૂર જણાય ત્યાં હાઈકોર્ટમાં અપીલ કરવાની કામગીરી કરવી અને હાઈકોર્ટમાં થયેલ રીટ પીટીશન દરમ્યાન તમામ માહિતી તૈયાર કરી એડવોકેટશ્રીને જાણકારી આપવી. જે કેસોમાં અમલ આપવાનો થતો હોય તેવા કેસોમાં યોગ્ય સત્તાની જરૂરી મંજૂરી મેળવવી તેમજ કમી થતા ટેક્સની ગણતરી કરી, ટેક્સ એકાઉન્ટ ખાતે ચેક કરાવવી અને ડીમાન્ડે તે અંગેની નોંધ મૂકવી.

રીફંડના બીલો: વેલ્યુએશન અપીલના ચુકાદાનો અમલ આપવાથી તેમજ ખાતાની અરજીનો નિકાલ થવાથી કરદાતાને જો રીફંડ આપવાનું થાય તો તે અંગેની ગણતરી કરાવી રીફંડનું બીલ બનાવી, પાસ કરાવવા ચીફ ઓડિટ ખાતે મોકલી આપવું.

૩.૯ એકાઉન્ટ અને ઓડિટ ઓબ્જેક્શન: પોતાના વોર્ડની પાછલી બાકી, ચાલુ ડીમાન્ડ, ચાલુ વર્ષની અને પાછલા વર્ષની વસુલાત વિગેરેના ઓકડાઓ તૈયાર કરવા તેમજ ઓડિટ ખાતા મારફતે કાઢવામાં આવેલા વાંધાઓનો ઝડપી નિકાલ કરવો.

૩.૧૦ જનરલ:

૩.૧૦.૧ ખાતાક્રિય માહિતીના સરકયુલરના જવાબો કરવા, ડી.સુ.ને જરૂરી માહિતી પૂરી પાડવી.

૩.૧૦.૨ બોર્ડ તથા કમીટીમાં પૂછાયેલ સવાલોના જવાબો તૈયાર કરવા માટે તેમજ બોર્ડમાં મૂકવામાં આવેલ દરખાસ્ત અંગેની માહિતી તૈયાર કરવા માટે ડી.સુ.ને જોઈતી માહિતી પૂરી પાડવી.

૩.૧૦.૩ રૂલ-૨૦, સરકયુલર-૧૪, કલમ-૪૮૫ હેઠળની અરજીઓના નિકાલ અંગે ડીમાન્ડ દાખલા ભરી, ફાઈલ તૈયાર કરી મંજૂરી મેળવવા ડી.સુ. શ્રીને સોંપવી.

૩.૧૦.૪ વોર્ડના તુમારોનો તેના નિકાલ થયા બાદ દફતરે કરાવવી.

૩.૧૦.૫ અરજદારોની આવેલી કોઈપણ પ્રકારની અરજી સંબંધમાં મંજૂરી મુજબ ડીમાન્ડ રજીસ્ટર સુધારા કરવા અને સુધારા મુજબના કમ્પ્યુટરના ફોર્મ ભરવા.

આ ઉપરાંત ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી તથા ઉપરી અધિકારીશ્રી તરફથી જે કામગીરી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

newstaff

(8)

(9)

ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ

૧. સુપરવીઝન:

ટેક્સ ખાતાના ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ તેને સોંપવામાં આવેલ બીટના વહીવટી અધિકારી છે. તેના હાથ નીચે જે તે બીટના ઈન્સ્પેક્ટર, ઓફિસ ક્લાર્ક, પટાવાળા, લુહાર, મજૂર ફરજ બજાવે છે. આ દરેક કર્મચારીની કામગીરીનું સુપરવીઝન કરવાનું હોય છે. આ કર્મચારીઓ નિયમીત સમયસર ફરજ પર આવે, તેઓની જગા ઉપર બજાવે, તેઓ જે કામગીરી કરે તેની ઉપર દેખરેખ રાખવી અને જરૂર પડે માર્ગદર્શન પૂરું પાડવાની ફરજ છે જે તે કર્મચારીની કેજ્યુઅલ રજા ભરાવવી, કેજ્યુઅલ રજાનું પત્રક રાખવું, હાજરી ચેક કરવી તેમજ આ કર્મચારીની ડાયરી રખાવવી અને ડાયરી તપાસવાની કામગીરી છે.

૨. રીકવરી:

પ્રોપર્ટી ટેક્સની રીકવરી અંગે નીચે મુજબ તબક્કાવાર કામગીરી હાથ ધરવાની છે.

૨.૧ બીલોની ચકાસણી કરાવવી, તેને લગતી ફરીયાદોનો નિકાલ કરાવવા, વાંધા અરજીઓવાળા બીલો કઢાવી લેવા, બીલો ઉપર જરૂરી સિકકા લગાડવા, બીલો વહેંચાવવા.

૨.૨ બીલના નાણાં ભરવાની છેલ્લી તારીખ પસાર થયા પછી બાકી પત્રક તૈયાર કરવા.

૨.૩ બીલ ઈસ્યુ થયા બાદ કરદાતા દ્વારા સ્ટે મેળવવામાં આવ્યો હોય તો તેની ડીમાન્ડ રજીસ્ટરે નોંધ કરવી અને રીકવરી સ્ટાફને તેની જાણ કરવવી.

૨.૪ પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હોય તેવા કરદાતા સામે રીકવરીના કડક પગલાં રૂપે છેલ્લી ચેતવણીના કાર્ડ લખવા, પાણીના કનેક્શન કાપવા, વોરંટ તૈયાર કરવા તથા તેને બજાવવાની કામગીરી કરવી.

૨.૫ વોરંટ ઈસ્યુ કર્યા બાદ જો કરદાતા પ્રોપર્ટી ટેક્સ ન ભરે તો તેની મિલકતની હરાજની કાર્યવાહી કરવાની થાય છે તે અંગે હરાજ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હરાજથી સેલ કન્ફર્મ સુધીની કાર્યવાહી કરાવવાની.

૨.૬ બીટની રીકવરીના ચેક સ્વીકારાયા વગર પરત આવે તે અંગે રીટર્ન ચેકનું રજીસ્ટર મેઈન્ટેઈન કર્યું અને રીટર્ન ચેકની રીકવરીની કામગીરી તાકિદે કરવી અને જો રીટર્ન ચેકની રીકવરી આવે તેમ ન હોય તો ડીમાન્ડે વધ કરવાની જરૂરી મંજૂરી મેળવવા તથા તે અંગે મંજૂરી મળ્યે નોંધ રાખવી અને તે મુજબ કમ્પ્યુટરમાં સુધારો કરાવવાની કાર્યવાહી કરાવવી.

૨.૭ પોતાની બીટના સ્ટાફ જેમ કે ઓફિસ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, લુહાર, મજૂર વિ.ની કામગીરીનું આયોજન કરવું અને રીકવરી સ્ટાફની કામગીરી ઉપર દેખરેખ રાખવી.

૨.૮ રીકવરી અંગે નાણાં સ્વીકારવા માટે રાખવામાં આવેલ કેશ કાઉન્ટર સ્ટાફની વ્યવસ્થા ગોઠવવી અને આ સ્ટાફની કામગીરીનું ચેકિંગ કરવું.

૨.૯ કરદાતાઓ તરફથી કર ભરવા અંગે માંગવામાં આવેલ હપ્તાની અરજી અંગે સક્ષમ સત્તાની મંજૂરી મેળવી આપેલ હપ્તા મુજબ સમયસર નાણાં ભરાય તે ચેક કરવાનું છે.

૨.૧૦ એક્ટની કલમ ૧૪૦ મુજબ મિલકતના કબજેદારને નોટિસ આપી ભરવાનું થતું ભાડું મ્યુનિ. ટેક્સ પેટે જમા કરાવવાની નોટિસ પાઠવવાની કામગીરી કરવી.

૩. મિલકતની આકારણીની કામગીરી:

ડી.સુ. મારફત તેની બીટમાં આવેલી મિલકતો અંગે નીચે જણાવેલ કારણોસર આકારણી કરવામાં આવે છે.

૧. વિજિલન્સ ઓફિસરના રીપોર્ટના આધારે

૨. ટી.ડી.ઓ. ખાતેથી આવેલ બી.યુ.પરમીશનની નકલ ઉપરથી

૩. ઈન્સ્પેક્ટર તરફથી આપવામાં આવેલ ૩ ફોર્મ ઉપરથી તથા કરવામાં આવેલ રિપોર્ટના આધારે

newstaff

(11)
(12)

(13)

૪. ખાતામાં આવેલ ટેક્સ જનરલની અરજીઓ જેવી કે ભાડાફોડ કરવા, નવેસરથી આકારણી કરવા વિ.
૫. સ્થળ તપાસમાં ચેકીંગ દરમ્યાન આકારણી રીવાઈઝ કરવા યોગ્ય હોય તેવી બાબત ધ્યાનમાં આવતા
૬. વેલ્યુએશન તથા એપેલેટ ઓફિસરની રીમાર્ક્સ ઉપરથી
૭. આ ઉપરાંત એક્ટની જોગવાઈઓ મુજબ મકાનોની આકારણી જરૂરી તપાસ બાદ કરવી.
આકારણી કરતી વખતે નીચેની વિગતો ધ્યાનમાં રાખવાની હોય છે.
જે તે મિલકતનો બાંધકામનો પ્રકાર, બાંધકામ ક્યા વર્ષમાં થયું છે, બાંધકામ ક્યા વિસ્તારમાં આવ્યું છે, બાંધકામનો ઉપયોગ, તેનો પ્રકાર, મિલકતના કબજેદાર-ભાડુઆત કે માલિક છે આ અંગેના પુરાવા, આજુબાજુ ઉપજતું ભાડું ધ્યાનમાં લેવું. આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને જે તે મિલકતનું ઉપજી શકતું ભાડું નક્કી કરવાની હોય છે.

૪. વાંધા અરજીઓ અંગેની કાર્યવાહી:
વાંધા અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા કરવાની તથા આવેલ વાંધા અરજીઓના ડીમાન્ડ દાખલા ભરાવીને વાંધા અરજીઓ એપેલેટ ખાતે મોકલવાની વ્યવસ્થા કરવાની છે. એપેલેટ ઓફિસર વાંધા અરજીઓના નિકાલ કરીને જે આકારણી ઠરાવે છે તે આકારણીના સુધારા ફોર્મ તથા હ.ર.ઠરાવ બુક મોકલી આપવામાં આવે છે તે મુજબ ડીમાન્ડ નોંધ કરાવવાની હોય છે. ડીમાન્ડ નોંધ રખાવ્યા બાદ તેના બીલો તૈયાર કરાવવા અગર તો બીલો જો કમ્પ્યુટરમાં બનીને આવી ગયા હોય તો જરૂરી સુધારો બીલ ઉપર તથા ડીમાન્ડ કરાવીને તે બીલ જે તે કરદાતાને પહોંચાડવાની કામગીરી કરાવવાની છે.

૫. પ્રોપર્ટી ટેક્સ સંબંધમાં આવતી વિવિધ અરજીઓનો નિકાલ કરવો:
ટેક્સ ખાતામાં આવતી અરજીઓને નીચે મુજબ વર્ગીકરણ પાડવામાં આવેલ છે.

૧. ટેક્સ ટી.એસ.એફ.	-નામ ટ્રાન્સફર
૨. ટેક્સ વેકેન્ટ	-ખાલી જગાની અરજી
૩. ટેક્સ કમ્પ્લેઈન	-વાંધા અરજી
૪. ટેક્સ-એનડબલ્યુસીઆર-	-નવુ વોટર કનેક્શન
૫. ટેક્સ જનરલ	-સરક્યુલર-૧૪, રૂલ-૨૦, કલમ-૪૮૫, ડુબ્લીકેશન આકારણી કમી કરવા, બીલો એકત્ર કરવા, ભાડાફોડ કરવા તથા નવેસરથી આકારણી કરી આપવા સંબંધમાં આવતી અરજીઓનો સમાવેશ થાય છે. કબજેદાર તથા ઉપયોગનો પ્રકાર ફેરફાર
૬. ટેક્સ જજમેન્ટ	-વેલ્યુએશન અપીલના ચુકાદાનો અમલ

૫.૧ નામ ટ્રાન્સફર: ટેક્સ ટી.એસ.એફ.ની અરજી: મિલકતોનું વેચાણ થવાથી મિલકત ખરીદનાર વ્યક્તિ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી રજીસ્ટરમાં પોતાનું નામ દાખલ કરવા નિયત ફોર્મમાં માહિતી સાથે અરજી આપે છે. આ અંગેના નામ ટ્રાન્સફરની જરૂરી કાર્યવાહી કરી યોગ્ય તે સત્તાની મંજૂરી મેળવવાની તથા આ કાર્યવાહી સમયસર થાય અને કોઈ ફરીયાદ ન રહે તે જોવાની જવાબદારી ડી.સુ.શ્રીની છે.

૫.૨ ટેક્સ વેકેન્ટ: (ખાલી અંગેની અરજી): કરદાતા દ્વારા પોતાની મિલકત કોઈપણ પ્રકારના ઉપયોગ વગર ખાલી છે તે અંગેની અરજી જારી તપાસ માટે ઈન્સ્પેક્ટરને આપવામાં આવે છે. જે મિલકતની આકારણી રૂ. ૧૦૦૦ થી રૂ. ૩૦૦૦ સુધી હોય તેવી મિલકતોની જગાઓ વર્ષના અંતે ડી.સુ.શ્રીને સ્થળ તપાસ માટે માર્ચ માસમાં બતાવવામાં આવે છે અને રૂ. ૩૦૦૦ થી ઉપરની આકારણી હોય તેવી મિલકતો જે તે વિભાગના આસિ.મેનેજર, ડે.એસેસર અને કલેક્ટર અથવા એસેસર અને ટેક્સ કલેક્ટરને વર્ષના અંતે સ્થળ તપાસમાં બતાવવામાં આવે છે. ઈન્સ્પેક્ટર ખાલીની જગાની નિયમિત સ્થળ તપાસ કરે છે કે કેમ? તેની ચકાસણી કરવી.

newstaff

(13)
pro act. 13

પ.૩ ટેક્સ કમ્પેઈન: (વાંધા અરજી): પ્રોપર્ટીની આકારણી અંગે કરવામાં આવેલ અરજીના નિકાલની કામગીરી એપેલેટ ઓફિસર મારફતે કરવામાં આવે છે. પરંતુ એપેલેટ ઓફિસરશ્રીનો નિષ્ક્રિય લેવા માટે જે માહિતી પૂરી પાડવાની છે તે કામગીરી ડી.સુ. મારફતે પૂરી પાડવામાં આવે છે જે અંગે આગળ ઉપર વિગતે જણાવેલ છે.

પ.૪ ટેક્સ (એનડબલ્યુસીઆર) નવા વોટર કનેક્શનની અરજી: પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ દ્વારા નવું વોટર કનેક્શન લેવા માટે પાણી ખાતે ફોર્મ ભરે છે તેમાં જે તે ટેનામેન્ટના સર્વે નંબર, સેન્સસ નંબરની ચકાસણી કરવી અને આ અંગેની અરજી કર્યા સુધીના વર્ષનો ટેક્સ પૂરેપૂરો વસુલ આવેલ છે કે કેમ? તેનું સર્ટિફિકેટ આપવાનું હોય છે. આ કામગીરી ઈન્સ્પેક્ટર ડીમાન્ડ ઉપર ખાત્રી કરી લખી જણાવે છે તેના ઉપર ડી.સુ. સહી કરે છે.

પ.૫ ટેક્સ જનરલ: ટેક્સ જનરલની આવેલ અરજીઓ અંગે ઓફિસ કલાર્ક મારફતે ડીમાન્ડ દાખલા ભરાવવાની કામગીરી કરાવવામાં આવે છે ત્યાંબાદ ડી.સુ.ને સાથે રાખીને જે તે અરજી સંબંધમાં સ્થળ તપાસ કરવી. સ્થળ તપાસ વખતે જે તે જગ્યાનું રેકર્ડ મુજબનું માપ છે કે કેમ? જગ્યાનાં ઉપયોગનો પ્રકાર રેકર્ડ મુજબ છે કે કેમ? જગ્યાના કબજેદાર અંગેની માહિતી- તેઓ માલિક-ભાડુઆત કે અન્ય છે તેની વિગત, માલિક હોય તો માલિકીના પુરાવા તપાસવા, કબજેદાર તરીકે રેશનીંગ કાર્ડ, ગેસ કનેક્શન, ગુમાસ્તાધારા લાયસન્સ, ટેલીફોન બીલ વિગેરે પુરાવા તપાસવાની કામગીરી હોય છે. આમ ટેક્સ જનરલની આવેલી અરજીનો અમલ આપવામાં જરૂરી હોય તેવા દસ્તાવેજ અસલ જોવા અને તેની નકલ સામેલ રાખવી ત્યારબાદ સક્ષમ સત્તાની મંજૂરી માંગવામાં આવે છે. આ અંગેની મંજૂરી મળ્યા બાદ અંજદારને સમયસર જાવક મળે તેવી વ્યવસ્થા કરવાની હોય છે અને ટેક્સના ડીમાન્ડ રજીસ્ટરે જરૂરી નોંધ રખાવવાની અને કોમ્પ્યુટરમાં જરૂરી સુધારા કરાવવા તજવીજ કરવાની હોય છે. સામાન્ય કરની માફી અંગે આવતી અરજીઓ અંગે સ્થળ તપાસ કરીને, અરજી સંબંધમાં છેલ્લા ત્રણ વર્ષના ઓડીટ હિસાબોની નકલ થેરીટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર થયા અંગેનું સર્ટી.ની નકલ, ઈ-કમ્પેટેક્સ માફી અંગેના સર્ટી.ની નકલ વિગેરે પુરાવા તપાસી સક્ષમ સત્તાની મંજૂરી માંગવામાં આવે છે.

પ.૬ કોર્ટ મેટર તથા વેલ્યુએશન અપીલ: કોર્ટ તરફથી આવેલ સમન્સ મુજબની માહિતી તૈયાર કરાવી અને કોર્ટમાં હાજર રહેવાની કાર્યવાહી કરવી, કરાવવી.

કરદાતા તરફથી આકારણી અંગે સ્મોલ કોઝ કોર્ટમાં દાખલ થયેલ વેલ્યુએશન અપીલ અંગે મ્યુફ એડવોકેટશ્રીને ડીમાન્ડ દાખલાના ફોર્મ ભરાવી મોકલી આપવા. વે.ઓ.ના ઠરાવની નકલ તથા એપેલેટ ઓફિસરના ઠરાવની નકલ તથા વકીલને જરૂરી હોય તેવા પુરાવા અને માહિતી આપવાની કાર્યવાહી કરવી. કોર્ટના ચુકાદાના અમલ અપાવવાની કામગીરી ઈન્સ્પેક્ટર મારફતે કરાવવી. સ્મોલ કોઝ કોર્ટના જજમેન્ટ કે જે કેસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને આર્થિક રીતે નુકશાની ભોગવવી પડે તેમ હોય તેવા કેસોમાં તેવા જજમેન્ટો ઉપરી અધિકારીના ધ્યાન પર લાવવા અને જરૂર જણાય ત્યાં હાઈકોર્ટમાં અપીલ કરવાની કાર્યવાહી કરાવવી. હાઈકોર્ટમાં થયેલ અપીલ રીટ પીટીશન અંગે જરૂરી તમામ માહિતી તૈયાર કરાવીને એડવોકેટશ્રીને જાણકારી આપવી, માહિતી આપવી વિગેરે.

૬. કમ્પ્યુટરમાં સુધારો કરાવવાની કામગીરી:

વર્ષ દરમિયાન ટેક્સ ડિમાન્ડે થયેલ સુધારા જેવા કે મકાનમાલિકના નામમાં ફેરફાર, સરનામામાં ફેરફાર, આકારણીમાં ફેરફાર, સર્વે નંબર, સેન્સસ નંબરમાં ફેરફાર, પ્લેટ એક્ટ કરવી, ભાડુઆત પોતે મકાને ખરીદે, ભાડુઆત બદલાય, વપરાશ બદલાયા હોય, કમી કરવાના હોય વિગેરે માટે જે તે મારફતે ટેક્સ રેકર્ડમાં કમ્પ્યુટરમાં સુધારો કરાવવા માટેના ફોર્મ સમયસર મોકલવાની વ્યવસ્થા કરવાની છે. આ કામગીરી ધણી મહત્વની છે તેમાં જો ખામી રહી જાય તો ડીમાન્ડ રજીસ્ટર, બીલ, બાકી પત્રક વિગેરે અનેક આનુસંગિક પત્રકોમાં તુલ ચાલુ રહેવા પામે છે. ઓફિસ કલાર્ક / વોર્ડ ઈન્સ્પેક્ટર કમ્પ્યુટર સુધારાના ફોર્મ ભરેલ છે તેમાં જે તે મંજૂરીની ફાઈલો સાથે ચકાસણી કરવી જોઈએ અને દરેક ફોર્મમાં ડી.સુ. શ્રીએ સહી કરવાની છે.

૭. જાહેરનામાની કામગીરી:

newstaff

એસેસમેન્ટ રજીસ્ટરમાં છેલ્લામાં છેલ્લા થયેલ સુધારાઓ નોંધીને તેને જાહેરનામાની તારીખ પહેલા અપડેટ કરાવવાની કામગીરી કરાવવાની હોય છે અને રજીસ્ટર ઉપર જરૂરી સહીસિક્કા કરાવીને સર્ટિફિકેટ આપવાની છે. જાહેરનામું પ્રસિદ્ધ થયેથી કરદાતાઓ પોતાની મિલકતોનું એસેસમેન્ટ શું છે? તે જોવા માટે આવે ત્યારે તેઓને એસેસમેન્ટ રજીસ્ટરો બતાવવાની વ્યવસ્થા ગોઠવવાની હોય છે.

૮. એકાઉન્ટ અને ઓડીટ ઓબ્જેક્શન:

પોતાના બીટમાં આવેલ વોર્ડની પાછલી બાકી, ચાલુ ડીમાન્ડ, ચાલુ વર્ષની અને પાછલા વર્ષની વસુલાત વિગેરેના આંકડાઓ તૈયાર કરવા, હિસાબોની મેળવણી કરવી- કરાવવી તેમજ ઓડિટ ખાતા મારફતે કાઢવામાં આવેલા વાંધાઓનું વ્યવસ્થિત પત્રક રાખવું અને તેનો ઝડપી નિકાલ કરાવવો.

૯. જનરલ કામગીરી:

૧. ખાતાકિય માહિતીના સરકયુલરના જવાબો કરવા.

૨. બોર્ડ તથા કમીટીમાં પૂછાયેલ સવાલોના જવાબો તૈયાર કરવા માટે તેમજ બોર્ડના મુકવામાં આવેલ દરખાસ્ત અંગેની માહિતી તૈયાર કરવી.

૩. રૂલ-૨૦, સરકયુલર-૧૪, કલમ-૪૮૫ હેઠળની અરજીઓના અલગ પત્રક રાખવા.

બીટના તુમારોનો તેના નિકાલ થયા બાદ દફતરે કરાવવી.

આ ઉપરાંત ઉપરી અધિકારી તરફથી જે કામગીરી સોંપવામાં આવે તે કામગીરી કરવી- કરાવવી તથા પોતાના તાબા હેઠળના કર્મચારીઓને કામગીરી અંગે માર્ગદર્શન આપવું.

પોતાની બીટના તારીખ, રોજમેળ, પોસ્ટેજ એકાઉન્ટ, રેવન્યુ રજીસ્ટર વગેરે જે તે સ્ટાફ તરફથી નિયમિત તૈયાર થાય છે કે કેમ? તે અંગેની દેખરેખ રાખી કામ નિયમિત કરાવવું. બજેટ અંગે માહિતી તૈયાર કરવા માટે જરૂરી માહિતી પોતાના સ્ટાફ પાસે તૈયાર કરાવવી.

(૩) નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી:-

મ્યુનિ.ટેક્સના નીતિ-નિયમો જોગવાઈ તથા થયેલ પાવર્સ ડેલીગેશન મુજબ જે-તે સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. જે વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

(૪) કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો:-

કરદાતા દ્વારા મ્યુનિ.ટેક્સને લગતી આવેલ અરજીઓનો ટેક્સના નીતિ-નિયમો, ધારા-ધોરણો, પરિપત્ર વખતોવખત સમયમર્યાદા માટે અમલી બનતી ઈન્સેન્ટીવ સ્કીમ મુજબ સક્ષમ સત્તાની મંજૂરી મેળવી નિકાલ કરવામાં આવે છે. જે વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

(૫) મધ્યઝોન ટેક્સ ખાતે આવેલ સીટી સિવિક સેન્ટરોની યાદી:-

ટેક્સ ખાતા દ્વારા થયેલ પરિપત્ર, નવી ફોર્મ્યુલા ટેક્સ પદ્ધતિના નીતિ-નિયમો, સુચનાત્મક આદેશો જે વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ કરદાતાઓની અરજીઓ અ.મ્યુ.કો.ના તમામ સીટી સિવિક સેન્ટરો ખાતે સ્વીકારવામાં આવે છે. મધ્યઝોન ટેક્સ ખાતે આવેલ સીટી સિવિક સેન્ટરોની યાદી નીચે મુજબ છે.

અ.નં	ઝોન	સીટી સિવિક સેન્ટર	એડ્રેસ	ફોન નંબર
૧	મધ્ય	રીલીફ રોડ	રૂપમ સિનેમા સામે, રીલીફરોડ, અમદાવાદ	૩૨૯૮૧૫૪૮ ૨૨૧૭૧૦૩૪
૨	મધ્ય	ગિરધરનગર	ગિરધરનગર વોર્ડ ઓફિસ, ગિરધરનગર,	૩૨૯૮૧૨૪૧ ૨૫૬૨૬૪૫૪
૩	મધ્ય	દુધેશ્વર	મ્યુ.બાલ ભવન, લાલાકાકા હોલ પાસે, દુધેશ્વર	
૪	મધ્ય	જમાલપુર	જે.પી.સ્ટોર, એ.એમ.ટી.એસ. સ્ટાફ ક્વાર્ટર્સ સામે, જમાલપુર	
૫	મધ્ય	દરીયાપુર	કુટી મસ્જિદ પાસે, રૂપાપરી પોળ, દરીયાપુર દરવાજા, દરીયાપુર	
૬	મધ્ય	શાહપુર	શાહપુર વોર્ડ ઓફિસ, બાપુ સ્મૃતિકુંજ શાહપુર ચાર રસ્તા પાસે,	
૭	મધ્ય	ખાડીયા	જુના આંગડીયા નાકા, મહિપતરામ આશ્રમ પાસે, રાયપુર	
૮	મધ્ય	દાણાપીઠ	મ્યુનિ.કોર્પો. કંપાઉન્ડ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ	૨૫૩૫૫૩૭૮
૯	મધ્ય	શાહીબાગ	ગિરધરવોર્ડ ,કિર્તી એપાર્ટમેન્ટ પાછળ, પાછળ, પ્રિતમપુરા મ્યુનિ.સ્કૂલ	૯૭૨૬૪૧૬૧૭૮

			નં.-૩-૪,કાનજીનગર ચાર રસ્તા,ગિરધરનગર,નગર,અમદાવાદ.	
૧૦	મધ્ય	અસારવા	નરોડા વોર્ડ ઓફિસ,રેન બસેરા,ચામુંદા સર્કલ ,ચામુંદા ઓવરબ્રીજ ,અમદાવાદ.	૯૭૨૬૪૧૫૮૪૧

મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સના કર દરની નવી ફોર્મ્યુલા મુજબ માહિતી

(અમલ તા.૧-૪-૨૦૦૧)

સામાન્યવેરાની ગણતરીની ફોર્મ્યુલા

સામાન્યવેરો = વાર્ષિક દર x મિલકતનું ક્ષેત્રફળ x (ફેક્ટર:૧ x ફેક્ટર:૨ x ફેક્ટર:૩ x ફેક્ટર:૪)

વાર્ષિક દર :

ઉપરોક્ત ફોર્મ્યુલામાં મિલકતનો વાર્ષિકદર ચો.મીટર દીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે બજેટ મંજૂર કરતી વખતે જાહેર કરશે અને દર નક્કી કરતી વખતે કોર્પોરેશને આગામી વર્ષ દરમ્યાન કોર્પોરેશનની નાણાકીય જરૂરિયાતો લક્ષમાં લેશે.

મિલકતનું ક્ષેત્રફળ :

મિલકતનું ક્ષેત્રફળ આકારણી હેઠળની મિલકતના કારપેટ એરીયા ઉપરથી નક્કી કરવામાં આવશે. કારપેટ એરીયા ગણતરી વખતે મિલકતની બાહ્ય અને આંતરિક દિવાલો હેઠળના ક્ષેત્રફળ સિવાયનું મિલકતનું તમામ ક્ષેત્રફળ ધ્યાને લેવાનું રહેશે.

વર્ષ ૨૦૧૩/૨૦૧૪ થી રહેઠાણની મિલકતો માટેનો પ્રતિ ચો.મી.વાર્ષિક દર રૂ.૧૬/- અને બિનરહેઠાણની મિલકતો માટેનો પ્રતિ ચો.મી. વાર્ષિક દર રૂ.૨૮/- નક્કી કરવામાં આવેલ છે.

ફેક્ટરના પ્રકાર અને ફેક્ટર લાગુ પાડવાની પદ્ધતિ

ફેક્ટર -: ૧ : સ્થળ પરિસ્થિતિ (Location) અંગેનો ફેક્ટર

અમદાવાદ શહેરનો કેટલોક વિસ્તાર સમૃદ્ધ છે, કેટલોક મધ્યમ કક્ષાનો છે અને કેટલાક વિસ્તારમાં ગરીબ પ્રજા રહે છે તેથી અલગ અલગ વિસ્તારની સમૃદ્ધિને લક્ષમાં લઈને સ્થળ સ્થિતિ અંગે ફેક્ટર લાગુ પાડવાના રહે છે તેથી પ્રવર્તમાન જમીનની કિંમત પરથી (અ) સમૃદ્ધ વિસ્તાર (બ) સારો વિસ્તાર (ક) મધ્યમ વિસ્તાર (ડ) નબળો વિસ્તાર એમ ચાર વિભાગ પાડેલ છે.

રહેઠાણ ની મિલકતો માટે	અવયવ
સમૃદ્ધ વિસ્તાર	૧.૬૦
સારો વિસ્તાર	૧.૧૦
મધ્યમ વિસ્તાર	૦.૮૦
નબળો વિસ્તાર	૦.૬૦

બિનરહેઠાણની મિલકતનો માટે વિસ્તારનું વિભાજન વધુ વાણિજ્ય શક્યતાઓ ધ્યાનમાં રાખીને કરેલ છે. સારી વાણિજ્ય શક્યતાવાળા વિસ્તારનો અવયવનો દર ઉંચો રાખવામાં આવેલ છે જ્યારે નબળા વાણિજ્ય શક્યતાવાળા વિસ્તારનો અવયવનો દર નીચો રાખવામાં આવેલ છે. આ અવયવોની કિંમત નીચે મુજબ રાખેલ છે.

બિનરહેઠાણ ની મિલકતો માટે	અવયવ
ખૂબ જ સારી	૧.૬૦
સારી	૧.૧૦
મધ્યમ	૦.૯૦
નબળી	૦.૬૦

રાજ્ય સરકારના સ્ટેમ્પ્સ ડ્યુટી વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો માટે જમીનની કિંમતો નક્કી થાય છે તેનો આધાર લઈને શહેરના આ પ્રમાણે વિભાજન કરવામાં આવશે.

ફેક્ટર : ૨ મિલકતના બાંધકામના વર્ષ આધારિત ફેક્ટર

અ.નં.	મિલકતની ઉંમર	અવયવનો દર
૧	દિશ વર્ષ કે તેથી ઓછા સમયની	૧.૦૦
૨	દશ વર્ષથી વધુ પરંતુ વીશ વર્ષ સુધી	૦.૮૫
૩	વીશ વર્ષથી વધુ પરંતુ ત્રીસ વર્ષ સુધી	૦.૭૦
૪	ત્રીસ વર્ષથી વધુ પરંતુ ચાલીસ વર્ષ સુધી	૦.૬૦
૫	ચાલીસ વર્ષ કરતાં વધુ સમયની	૦.૫૦

ફેક્ટર : ૩

(અ) રહેઠાણવાળી મિલકતોના પ્રકાર અંગેનો ફેક્ટર:

અમદાવાદ શહેરમાં રહેઠાણવાળી મિલકતોના જુદા જુદા પ્રકારો છે:

(૧) ઝુંપડા (૨) ચાલી (૩) પોળ અને ગામતળના રહેઠાણવાળા મકાનો (૪) ફ્લેટ (૫) રોહાઉસ-ટેનામેન્ટ (૬) સ્વતંત્ર બંગલા

શહેરમાં આવેલી તમામ રહેણાંકની મિલકતોને ઉપરના પ્રકારો મુજબ વહેંચી તેના માટે નીચે મુજબના અવયવના દર રાખેલ છે.

અ.નં.	મિલકતોનો પ્રકાર	અવયવનો દર
૧	ચાલી (૨૫ ચો.મી. કરતાં વધુ)	૦.૫૦
૨	પોળ અને ગામતળના રહેઠાણવાળા મકાનો	૦.૭૦
૩	ફ્લેટ	૦.૭૦
૪	રો હાઉસ, ટેનામેન્ટ	૧.૦૦
૫	સ્વતંત્ર બંગલા	૧.૫૦

(બ) બિનરહેઠાણવાળી મિલકતોના પ્રકાર અંગેનો ફેક્ટર:

અમદાવાદ શહેરમાં વસવાટ સિવાયની મિલકતો જેનો જુદા જુદા પ્રકારે વપરાશ થાય છે. વપરાશને લક્ષમાં લઈ નીચે મુજબનું વિભાજન કરવામાં આવેલ છે અને તેના અવયવો નીચે મુજબ રાખવામાં આવેલ છે.

ક(૧) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૭.૦

વાણિજ્યિક હેતુઓ :

બેન્ક, દેવાખાનું, હોસ્પિટલ, ક્લીનિક, પ્રસુતિગૃહ, લેબોરેટરી, કેન્દ્ર સરકારની કચેરી, રાજ્ય સરકારની કચેરી, સ્થાનિક મંડળોની કચેરી, પોસ્ટ ઓફિસ, વાણિજ્યિક અને/ અથવા ઔદ્યોગિક એકમોની કચેરી, ઓઈલ કું.ની ઓફિસ, વિવિધ કોર્પોરેશનની ઓફિસો, ટ્યુશન વર્ગો, ટાઈપીંગ સંસ્થા, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ અને આ ખંડના બીજા કોઈ પણ પેટા ખંડમાં આવતી ન હોય તે ઈમારતો

(૨) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૬.૦

દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો વગેરે:-

દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો, ઓપન એર થીયેટર, પેટ્રોલ પંપ, સર્વિસ સ્ટેશન, સીનેમા, ક્લબ હાઉસ, જીમખાના, ક્લબની મેસ, લોજીંગ, લોજીંગ એન્ડ બોર્ડિંગ, પાર્ટી પ્લોટ (કોમ્યુનીટી હોલ સિવાય) ડીશ એન્ટેના, પેજર એન્ટેના ટાવર, સાઈન બોર્ડ, જાહેરખબરના પાટીયા, મોબાઈલ ફોન ટાવર, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ.

(૩) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૨.૦

ઔદ્યોગિક એકમો અને કારખાના (ફકત ઉત્પાદન તથા પ્રોસેસીંગ કરતી ઈમારતો માટે):-

વીજળી કંપનીનું પાવર હાઉસ, વીજળી સબ-સ્ટેશન, એરેટેડ વોટર ફેક્ટરી, ભઠ્ઠા, બ્રાસ વર્ક્સ, બ્રીક અને સીરામીક વર્ક્સ, સીમેન્ટની વસ્તુઓ, કલે બનાવવાના એકમો, કેમીકલ ફેક્ટરી, કન્ફેક્શનરી, ડેરી, ડીસ્ટીલીયરી, ફાઉન્ડ્રી, ફ્લોર ફેક્ટરી, આયર્ન ફેક્ટરી, ઝીન્ક ફેક્ટરી, સીલ્વર ઓનિમિન્ટ ફેક્ટરી, જગરી બનાવવાનું એકમ, લેધર મેન્યુફેક્ચરીંગ યુનીટ, યુના ચકકી, યુના ભઠ્ઠી, ઓઈલ એક્સ્ટ્રેક્શન, પેપર મેન્યુ., પ્લાસ્ટીક ફેક્ટરી, પોટરી, સાગોળ મેન્યુ., સોપ મેન્યુ., સુગર મેન્યુ., ટીન ફેક્ટરી, તમાકુ ફેક્ટરી, વર્ક્શોપ, ફેક્ટરી સ્ટીમ ઝીલ, ઓટો ગેરેજ, ફેક્ટરી - એ, બી, સી, ડી, ઈ, એફ, મીલ, પાવરલુમ, હેન્ડલુમ, બોર્ન વોર્શીંગ, બ્લીચીંગ, કોટન સ્પીનિંગ અને ડાઈંગ, ડાઈંગ બ્લીચીંગ, ધાણાળાઈ ફેક્ટરી, લેધર પ્રોસેસીંગ, સ્કીન પ્રીન્ટીંગ, સલ્ફર પ્રોસેસીંગ, સ્ટાર્ચ પ્રોસેસીંગ, વરીયાળી પ્રોસેસીંગ, વુલ પ્રોસેસીંગ, કોલ્ડ સ્ટોરેજ, લાકડા પીઠા, ભઠીયારખાના, રીપેરીંગ વર્ક્સ, નર્સરી (ફુલ છોડ), એનીમલ માર્કેટ, ઢોરના તબેલા, પોલ્ટ્રી ફાર્મ, દુધાળા ઢોરનો તબેલો, વે બ્રીજ, બાઈન્ડીંગ પ્રેસ, પ્રિન્ટીંગ પ્રેસ, પ્રોસેસ સ્ટુડીયો, ફોટો સ્ટુડીયો, કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ

(૪) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૨.૦

શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ:-

ખાનગી નર્સરી (બાલમંદિર), ખાનગી અને સરકારી શાળાઓ, ખાનગી અને સરકારી કોલેજો, યુનિવર્સિટી કેમ્પસ, મ્યુઝીયમ, કોમ્યુનિટી હોલ, પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સામાજિક સંસ્થાઓ (નારી સંરક્ષણ તથા ઉત્થાન, ઘરડાઘર, બહેરામુંગા, અંધજન, મંદબુધ્ધિ, શારીરિક ખોડખાંપણ સાથે સંકળાયેલી સંસ્થાઓ) તથા નોન ગ્રાન્ટેબલ શાળાઓ.

(બ) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં, મુકરર કરેલ દર વધારી શકાશે નહિ અથવા ધટાડી શકાશે નહિ:

પાણીની ટાંકી, વોટર પંપ રૂમ, ટ્રેનેજ પંપીંગ સ્ટેશન, ધોબીઘાટ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાતી ગ્રાન્ટેબલ શાળાઓ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવાતી હોય તેવી બોર્ડિંગ-લોજીંગ-હોસ્ટેલ, ધર્મશાળા, આશ્રમ, ગ્રંથાલય

(ગ) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં, મુકરર કરેલ દર ,0.0 વડે ગુણતાં જે આવે તેટલો ધટાડવો જોઈશે.

મંદિર, મસ્જીદી, ટેરાસર (જૈન મંદિર), ચર્ચ, રોજા, કબર, ગુરૂદ્વારા (શીખ મંદિર), અપાસરા, દરગાહ, અગિયારી, સમાધિ, ગ્રેબયાર્ડ, કબ્રસ્તાન, સ્મશાગૃહ, કુવો, હવાડો, હમામખાના (જાહેર બાથ), માટીના અખાડા, મદ્રેશા, પાઠશાળા, મફત પાણીની પરબ

ફેક્ટર : ૪ મિલકતનો ઉપયોગ કોણ કરે છે તેને આધારિત ફેક્ટર:

હાલમાં માલિક તાબે મિલકતોને ધણો જ ઓછો ટેક્સ ભરવો પડે છે જ્યારે ભાડુઆતને વધારે ટેક્સ આવે છે. બન્ને એકજ સરખી સવલતો ભોગવતા હોવા છતાં ટેક્સમાં મોટો તફાવત રાખવો યોગ્ય જણાતો નથી.તેથી નવી ફોર્મ્યુલામાં મોટો તફાવત નહીં રાખતા ભાડુઆત તાબે મિલકતને થોડી રાહત આપવાનું યોગ્ય જણાયું છે.

અ.નં	મિલકતનો ભોગવતા પરિભળ	અવયવ
૧	માલિકના ભોગવતાવાળી મિલકતો	૧.૦૦
૨	ભાડવાતના ભોગવતાવાળી મિલકતો	૨.૦૦

કલમ ૧૪૧ઈ (૧) તથા (૨) મુજબ શહેરની જે મિલકતો નોન-વોટર ઝોનમાં સમાવિષ્ટ થાય છે તેને તેના સામાન્ય કરમાં ૧૫% રિબેટ આપવામાં આવશે તથા બીનરહેણાંકવાળી ગ્રાઉન્ડ ફ્લોર સિવાયની મિલકતોના સામાન્ય કરમાં ૨૦% રિબેટ આપવામાં આવશે.

આમ છતાં, ઓછામાં ઓછો સામાન્ય વેરો નીચે મુજબ રહેશે.

(અ) રહેણાંકવાળી મિલકતો માટે:

અ.નં	મિલકતનો પ્રકાર	મિલકતનું માપ (ચો.મીટર)	લઘુત્તમ સામાન્ય વેરો
૧	ઝૂંપડા	--	૮૪.૦૦
૨	ચાલી	૨૫ ચો.મી. થી નાના	૨૬૪.૦૦
૩	અન્ય	૩૦ ચો.મી. થી નાના	૨૬૪.૦૦
૪	અન્ય	૩૦ ચો.મી. થી ૫૦ ચો.મી.	૩૦૦.૦૦

		સુધીના	
૫	અન્ય	૫૦ ચો.મી.થી વધુ	૩૩૦.૦૦

ઝુંપડા માટે મહત્તમ લઘુત્તમ સામાન્ય વેરો રૂ.૮૪/- તથા ૨૫ ચો.મી.થી નાના મકાનોવાળી ચાલીઓ માટે મહત્તમ લઘુત્તમ સામાન્ય વેરો રૂ. ૨૬૪/- રહેશે.

(બ) બીનરહેણાંકવાળી મિલકતો માટે:

અ.નં	મિલકતનો પ્રકાર	મિલકતનું માપ (ચો.મીટર)	લઘુત્તમ સામાન્ય વેરો
૧	બિનરહેણાંક	૧૫ ચો.મી. થી નાના	૫૪૦.૦૦
૨	બિનરહેણાંક	૧૫ ચો.મી. થી ૩૦ ચો.મી. સુધીના	૬૬૦.૦૦
૩	બિનરહેણાંક	૩૦ ચો.મી.થી વધુ	૭૮૦.૦૦
૪	પરિશિષ્ટ ૩ અને ઈ માં ઈશાવિલ બિનરહેણાંક	-----	૮૦૦.૦૦

વોટર ટેક્સ: સામાન્ય વેરાના ૩૦% પ્રમાણે કોન્ઝર્વેન્સી ટેક્સ: સામાન્ય વેરાના ૩૦% પ્રમાણે પાણીના મીટર કનેક્શન માટે પ્રોરેટા ચાર્જીસ પદ્ધતિ અનુસાર કનેક્શનની સાઈઝ પ્રમાણે વાર્ષિક પ્રોરેટા ચાર્જ નીચે મુજબ લેવાય છે.

માંગેલ કને.સાઈઝ	૧/૨ ઈંચ		
મેઈન લાઈનની સાઈઝ	ભરવાપાત્ર રકમ રૂપિયામાં		
	રહેઠાણ રૂ.૩/-	કોમર્શિયલ રૂ.૮/-	એરકન્ડીશન/ ચણતર ફી રૂ.૨૦/-
૩ ઈંચથી ૪ ઈંચ સુધી	૮૭૮/-	૨૩૪૪/-	૫૮૬૦/-
૪ ઈંચથી વધુ અને ૮ ઈંચ સુધી	૧૦૬૫/-	૨૮૪૦/-	૭૧૦૦/-
૮ ઈંચથી વધુ ૧૨ ઈંચ સુધી	૧૩૦૫/-	૩૪૮૦/-	૮૭૦૦/-

૩/૪ ઈંચ			૧ ઈંચ		
ભરવાપાત્ર રકમ (રૂપિયામાં)			ભરવાપાત્ર રકમ (રૂપિયામાં)		
રહેઠાણ રૂ.૩/-	કોમર્શિયલ રૂ.૮/-	એરકન્ડીશન/ ચણતર ફી રૂ.૨૦/-	રહેઠાણ રૂ.૩/-	કોમર્શિયલ રૂ.૮/-	એરકન્ડીશન/ ચણતર ફી રૂ.૨૦/-
૨૪૨૪/-	૬૪૬૪/-	૧૬૧૬૦/-	૪૮૮૬/-	૧૩૨૮૬/-	૩૩૨૪૦/-
૨૮૫૮/-	૭૮૮૮/-	૧૯૭૨૦/-	૬૧૦૫/-	૧૬૨૮૦/-	૪૦૭૦૦/-

૩૬૨૭/-	૯૬૯૨/-	૨૪૧૮૦/-	૭૪૬૭/-	૧૯૯૧૨/-	૪૯૭૮૦/-
--------	--------	---------	--------	---------	---------

અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં ભેળવવામાં આવેલ નગરપાલિકા અને પંચાયતના વિસ્તારો માટે

બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯ની કલમ-૪૫૫ હેઠળ મળેલ સત્તાની રૂઠંએ અમીલાવી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મિલકત વેરાની વસુલાત અંગે કારપેટ એરીયા બેઝ ફોર્મ્યુલા હેઠળ મિલકત વેરાની વસુલાત કરવા સંબંધિત ૨૦૦૧-૨૦૦૨થી અમલમાં મુકેલ બી.પી.એમ.સી. એક્ટની કલમ-૧૪૧(બી) મુજબની પ્રોપર્ટી ટેક્ષની કારપેટ એરીયા બેઈઝ, નવી ફોર્મ્યુલાના શીડ્યુલ-એ, પ્રકરણ-૮માં નિયમ-૮(છ)નો ઉમેરો.

૮(છ) અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં ભેળવવામાં આવેલ વિસ્તારો માટે મિલકત વેરાના ખાસ નિયમો.

ગુજરાત સરકારશ્રીના જાહેરનામા ક્રમાંક: કેવી/૨૫/૨૦૦૬/એએમએન/૯૦૨૦૦૬/૪૧૦/પી, તા:૧૪/૦૨/૨૦૦૬ થી ૭ (સાત) નગરપાલિકાઓના વિસ્તારોને તથા જાહેરનામા ક્રમાંક: કેવી/૨૧૧/૨૦૦૬/એએમએન/૯૦૨૦૦૬/૪૧૦/પી, તા:૨૦/૦૭/૨૦૦૬ થી ૧૦(દસ) નગરપાલિકાઓ તથા ૩૦(ત્રીસ) ગ્રામપંચાયતોના વિસ્તારને સમાવતી મહાનગરપાલિકાની હદમાં ભારતના બંધારણની કલમ ૨૪૩(ક્યુ)(૨) ની જોગવાઈ હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે. આ તમામ નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોના વિસ્તારને સમાવતી મહાનગરપાલિકાની હદમાં સમાવવામાં આવતાં તેઓના વિસ્તારની મિલકતોનો મિલકત વેરો બી.પી.એમ.સી.એક્ટ, ૧૯૪૯ ની કલમ-૧૪૧(બી) મુજબ લેવાનો થાય છે પરંતુ આ વિસ્તારોના વિકાસને ધ્યાને રાખતાં આ વિસ્તારો સમાવતી વખતે જે મિલકતોની આકારણી થયેલ છે તેમજ જો કોઈ મિલકતની આકારણી થયેલ ન હોય પરંતુ તેનું બાંધકામ મહાનગરપાલિકામાં સમાવેશ થતાં પહેલાં પૂર્ણ થયેલ હોય તો તે અંગેના પુરાવા રજૂ કરેથી આવી મિલકતો માટે લેવાનો થતો મિલકત વેરો તથા અન્ય કર/ચાર્જ નીચે મુજબના નિયમોથી લેવાના રહેશે.

૧. વર્ષ ૨૦૦૬-૨૦૦૭ માટે ઉપરોક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરાયેલ નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોના વિસ્તારમાં આવેલ મિલકતોનો મિલકત વેરો જે તે નગરપાલિકા તથા ગ્રામ પંચાયતો પૈકી જ્યાં સમાવેશ થયા પહેલાં બીલીગ થયેલ ના હોય તેવા વિસ્તારોમાં વર્ષ ૨૦૦૫-૨૦૦૬નું મિલકત વેરો/ઘર વેરો તથા અન્ય કર/ચાર્જનું જે બીલ આપવામાં આવેલ છે તે મુજબ જ મિલકત વેરો/ઘર વેરો તથા અન્ય કર/ચાર્જ લેવાના રહેશે અને જેમાં બીલીગ થઈ ગયેલ છે તેમાં તે બીલ મુજબ મિલકત વેરો લેવાનો રહેશે.

૨. વર્ષ ૨૦૦૭-૨૦૦૮થી ઉપરોક્ત વિસ્તારોમાં બી.પી.એમ.સી.એક્ટ, ૧૯૪૯ ની કલમ ૧૪૧(બી) મુજબ તથા તેના નિયમો ૮(ક) થી ૮(ચ) પ્રમાણે તથા અન્ય નિયમો મુજબ મિલકત વેરાની ગણતરી કરીને આખરી મિલકત વેરો તથા અમીલાવી મહાનગરપાલિકા દ્વારા નક્કી કરેલ વોટર સુઅરેજ ચાર્જની મળી જે રકમ આવે તે રકમ જે તે નગરપાલિકા/ગ્રામ પંચાયતના સને ૨૦૦૬-૨૦૦૭ની મિલકત વેરા/ઘર વેરા તથા અન્ય કર/ચાર્જ મળીને જે રકમ હોય તેના કરતાં વધારે થતી હોય તેવા કિસ્સામાં આ બંનેના તફાવતની રકમમાં નીચે મુજબ વર્ષ પ્રમાણે વળતર આપવામાં આવશે.

- (અ) વર્ષ ૨૦૦૭-૨૦૦૮ના નાણાંકીય વર્ષ માટે ૭૫ ટકા વળતર આપવું.
- (બ) વર્ષ ૨૦૦૮-૨૦૦૯ના નાણાંકીય વર્ષ માટે ૫૦ ટકા વળતર આપવું.
- (ક) વર્ષ ૨૦૦૯-૨૦૧૦ના નાણાંકીય વર્ષ માટે ૨૫ ટકા વળતર આપવું.

(૩) વર્ષ ૨૦૧૦-૨૦૧૧ના નાણાકીય વર્ષથી ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ મુજબ ટેક્ષ લેવામાં આવશે.

પરંતુ આ વળતર બી જે રકમ રહે તે મહાનગરપાલિકા માટે કલમ-૧૪૧(બી)(પ) મુજબ જે ઓછામાં ઓછો કર રાજ્ય સરકારે નક્કી કરેલ છે તથા નક્કી કરેલ વોટર સુઅરેજ ચાર્જ કરતાં ઓછો થવો જોઈએ નહીં.

શિક્ષણ ઉપકરના દર:

શિક્ષણ ઉપકરના દરો ગુજરાત એક્ટ નં. ૧૦ ઓફ ૨૦૦૬ તા.૩૧-૩-૨૦૦૬ નીચે મુજબ છે.

મિલકત વેરો	શિક્ષણ વેરાનો દર	
	રહેઠાણ	બીનરહેઠાણ
રૂ.૨૦૦ થી વધુ પરંતુ રૂ.૫૦૦ કે તેથી ઓછા મિલકતવેરા માટે	૫ ટકા	૧૦ ટકા
રૂ.૫૦૦ થી વધુ પરંતુ રૂ.૩૦૦૦ કે તેથી ઓછા મિલકતવેરા માટે	૧૦ ટકા	૨૦ ટકા
રૂ.૩૦૦૦ થી વધુ મિલકતવેરા માટે	૧૫ ટકા	૩૦ ટકા

વ્યવસાયવેરા વિભાગ

રાજ્ય સરકારે તા.૦૧-૧૦-૨૦૦૬ થી વ્યવસાયવેરાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કલેક્ટીંગ એજન્ટ તરીકે સોંપેલ. ત્યારબાદ તા.૧-૪-૨૦૦૮ થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ડેગ્રીનેટેડ ઓથોરીટી તરીકે વેરો લાદવાની તથા વસુલ કરવાની તમામ કામગીરી સોંપવામાં આવેલ છે. વ્યવસાયવેરાને પાત્ર નવા કરદાતાઓની નોંધણી, જુના કરદાતા અને નવા કરદાતાઓની બાકી વેરાની વસુલાતની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વ્યવસાયવેરાને લગતી તમામ કામગીરી ઝોન પ્રમાણે કરવામાં આવે છે.

વ્યવસાયવેરા ખાતાની કામગીરી:

વ્યવસાયવેરા ખાતા દ્વારા વ્યવસાયવેરાને પાત્ર થતા હોય તેવા એનરોલમેન્ટ સર્ટિફિકેટ હોલ્ડર (ઈ.શી.હોલ્ડર) અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોલ્ડર (આર.સી.) ની વેરો લાદવાની તથા વસુલ કરવાની કામગીરી જે તે ઝોન દ્વારા ઉપર જણાવેલ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. વ્યવસાયવેરો ભરવા માટે વ્યક્તિએ નીચે મુજબની કાર્યવાહી કરવાની થાય.

તાજેતરમાં ગુજરાત સરકાર કાયદાકીય અને સંસદીય વિભાગ તરફથી તા.૦૯ એપ્રિલ ૨૦૨૧ના રોજથી ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિધ્ધ ગુજરાત વ્યવસાય, વ્યાપાર ધંધા રોજગાર વેરા અધિનિયમ-૧૯૭૬માં નવાં અનુસૂચિ-૧માં મંજૂર કરવામાં આવેલ સુધારા ગુજરાત સરકાર ગેઝેટ,EX.09-04-2021 ગુજરાત સ્ટેટ ટેક્સ ઓન પ્રોફેશન્સ, ટ્રેડ્સ, કોલિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ એક્ટ, 1976માં અનુસૂચિનો ભાગ IV સુધારો 2. અનુસૂચિ 1 માં, ક્રમ નં. 7, નીચેની એન્ટ્રી દાખલ કરવામાં આવશે, એટલે કે:-

અનુસૂચિ 1

(જુઓ વિભાગ 3 અને કલમ 5(3))

વ્યવસાયો, વેપાર, કોલિંગ અને રોજગાર પરના કરના દરો

અ.નુ.	વ્યક્તિઓનો વર્ગ	કરનો મહત્તમ દર(રૂ.માં)
૧	૨	૩
	<p>"7 (A) ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017 (ગુજ. 25 ઓફ 2017) માં વ્યાખ્યાયિત કર્યા મુજબ સપ્લાયર જેનું રાજ્યમાં ટર્નઓવર</p> <p>(i)રૂ.૨,૫૦,૦૦૦/- કરતાં વધુ નહીં</p> <p>(ii)રૂ.૨,૫૦,૦૦૦ કરતાં વધુ પરંતુ ૫,૦૦,૦૦૦ કરતાં વધુ નહીં</p> <p>(iii)રૂ.૩.૫,૦૦,૦૦૦/- કરતો વધુ પરંતુ ૧૦,૦૦,૦૦૦ કરતાં વધુ નહીં</p> <p>(iv)રૂ.૩.૧૦,૦૦,૦૦૦ કરતાં વધુ</p> <p>સમજૂતી; આ પ્રવેશના હેતુ માટે, "રાજ્યમાં ટર્નઓવર" શબ્દનો અર્થ (ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017(ગુજ. 25 2017) કોઈપણ નાણાકીય વર્ષ અથવા તેના ભાગ દરમિયાન</p>	<p>(i)શૂન્ય</p> <p>(ii)વાર્ષિક રૂ.૨૫૦૦/-</p> <p>(iii) વાર્ષિક રૂ.૨૫૦૦/-</p> <p>(iv) વાર્ષિક રૂ.૨૫૦૦/-</p>

એનરોલમેન્ટ સર્ટિફિકેટ મેળવવા માટે વ્યવસાયકારે ફોર્મ નં.૩ માં જરૂરી વિગતો ભરી પ્રોપર્ટી ટેક્સ બીલની નકલ, ગુમાસ્તાધારા હેઠળ નોંધણીની નકલ, પાન કાર્ડની નકલ, કંપની નોંધણીની નકલ, વેટ હેઠળ નોંધણીની નકલ જેવા આનુષંગિક પુરાવાઓ રજૂ કરવા જોઈએ.

ફોર્મ નં.૩ કોઈપણ સીટી સીવીક સેન્ટર અથવા ઝોનલ ઓફિસ પ્રોફેશનલ ટેક્સ વિભાગમાંથી વિનામુલ્યે ઉપલબ્ધ છે. તેમજ આ ફોર્મ અ.મ્યુ.કોર્પોરેશનની વેબસાઈટ **www.egovamc.com**. પર પ્રોફેશનલ ટેક્સમાં લીન્ક કરી ડાઉનલોડ કરી કોપી કાઢી શકાશે. વ્યવસાયવેરો ભરવા માટે કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર રોકડેથી અથવા ચેક / ડીમાન્ડ ડ્રાફ્ટ અમદાવાદ ખાતે પેયેબલ હોય તેવો મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ નામનો લખી ભરી શકાશે. ચેકની પાછળ નોંધણીનો નંબર, અરજદારનું નામ, સરનામું, ટેલિફોન નંબરની વિગત દર્શાવવી. વ્યવસાયવેરો ભરવા માટે કોઈ ચલણની જરૂરિયાત નથી.

૧. રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ: (આર.સી.) રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અ.મ્યુ.કોર્પોરેશનની હદમાં જે એમ્પ્લોયર એક અથવા તેથી વધુ કર્મચારીઓને નોકરીએ રાખતા હોય અને તેઓ પગાર અથવા વેતનની ચુકવણી કરતાં હોય તેમણે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે.

રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે એમ્પ્લોયરે ફોર્મ નં.૧ માં જરૂરી વિગતો ભરી પ્રોપર્ટી ટેક્સ બીલની નકલ, ગુમાસ્તાધારા હેઠળ નોંધણીની નકલ, પાન કાર્ડની નકલ, કંપની નોંધણીની નકલ, વેટ હેઠળ નોંધણીની નકલ જેવા આનુષંગિક પુરાવાઓ રજૂ કરવા જોઈએ.

ફોર્મ નં.૧ કોઈપણ સીટી સીવીક સેન્ટર અથવા ઝોનલ ઓફિસ પ્રોફેશનલ ટેક્સ વિભાગમાંથી વિનામુલ્યે ઉપલબ્ધ છે. તેમજ આ ફોર્મ અ.મ્યુ.કોર્પોરેશનની વેબસાઈટ **www.egovamc.com**. પર પ્રોફેશનલ ટેક્સમાં લીન્ક કરી ડાઉનલોડ કરી કોપી કાઢી શકાશે. વ્યવસાયવેરો ભરવા માટે કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર રોકડેથી અથવા ચેક / ડીમાન્ડ ડ્રાફ્ટ અમદાવાદ ખાતે પેયેબલ હોય તેવો મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ નામનો લખી ભરી શકાશે. ચેકની પાછળ નોંધણીનો નંબર, અરજદારનું નામ, સરનામું, ટેલિફોન નંબરની વિગત દર્શાવવી. વ્યવસાયવેરો ભરવા માટે કોઈ ચલણની જરૂરિયાત નથી.

જે એમ્પ્લોયરે ૨૦ કે તેથી ઓછા કર્મચારીઓ નોકરી ઉપર રાખ્યા હોય તેમણે નીચે જણાવેલા દરો મુજબ વેરો કાપી દર ત્રણ માસ પુરા થયા બાદ દિન-૧૫ માં તેમજ જે એમ્પ્લોયરે ૨૦ થી વધુ કર્મચારીઓ નોકરી ઉપર રાખ્યા હોય તેમણે નીચે જણાવેલા દરો મુજબ વેરો કાપી દર માસે માસ પુરો થયાના દિન-૧૫ માં કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર વ્યવસાયવેરો ભરવાનો થાય. તાજેતરમાં ગુજરાત રાજ્યના નાણાં ખાતા દ્વારા તા.૦૮/૦૪/૨૦૨૨ નાં રોજ બહાર પાડેલ નોટીફિકેશન ગુજરાત રાજ્ય નંબર GHN-35-PFT-2022-S-3(2)(10)-થ: ની કવાયતમાં ગુજરાત સ્ટેટ ટેક્સ ઓન પ્રોફેશન્સ, ટ્રેડ્સ, કોલિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ એક્ટ, 1976 (પ્રમુખનો અધિનિયમ નં. 11 ઓફ 1976) ની કલમ 3 ની પેટા-કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓ અને નાણા વિભાગ નં. GHN-11)-PFT-2008-S-3(2)(4)-TH તારીખ 01.04.2008. ૨૬ કરીને ઉપરોક્ત આ સદર વેરાના અધિનિયમના શેડ્યૂલની કોલમ 2 માં ઉલ્લેખિત વ્યક્તિઓના વર્ગ માટે, અહીં ઉમેરેલ શેડ્યૂલના કોલમ 3માં ઉલ્લેખિત કરવેરાના દર ઠરાવે છે,

અ.નં.	વ્યક્તિઓનો વર્ગ	દર મહિને કરનો દર
૧	૨	૩
૧	<p>A) રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પંચાયતો, રાજ્ય અને સરકારના ઉપક્રમો અને ગ્રાન્ટ-ઇન-એડ્સ સંસ્થાઓના પગાર અને વેતન મેળવનારાઓ, જેમનો માસિક પગાર અથવા વેતન</p> <p>(i) રૂ.૧૨૦૦૦/- સુધી</p> <p>(ii) રૂ. ૧૨૦૦૦/- થી વધુ</p> <p>(B) પેટા-એન્ટ્રી(A) માં ઉલ્લેખિત સિવાયના પગાર અને વેતન મેળવનારા, જેનો માસિક પગાર અથવા વેતન</p> <p>(i) રૂ.૧૨૦૦૦/- સુધી</p> <p>(ii) રૂ. ૧૨૦૦૦/- થી વધુ</p> <p>સમજૂતી 1. જ્યાં કોઈપણ વેતન અથવા વેતન છે એક મહિના સિવાયના કોઈપણ સમયગાળા અનુસાર ચૂકવવાપાત્ર, માસિક પગાર અથવા વેતન, આ પ્રવેશના હેતુ માટે, વેતન અથવા વેતનની વાસ્તવિક રકમના આધારે ગણવામાં આવશે અથવા એક મહિના માટે ચૂકવવાપાત્ર રહેશે સમજૂતી II. કોઈપણ મહિનાના અંત પહેલા વેતન મેળવનાર, તે મહિના માટે કર ચૂકવવાની તેની જવાબદારી પ્રમાણસર ઘટાડવામાં આવશે. જ્યાં કોઈ વ્યક્તિનો પગાર બંધ થાય</p>	<p>(i) શૂન્ય</p> <p>(ii) રૂ.૨૦૦/-</p> <p>(i) શૂન્ય</p> <p>(ii) રૂ.૨૦૦/-</p>

ખાસ નોંધ:- રાજ્ય સરકારે તા.૧-૪-૨૦૦૮ થી અમલી બને તે રીતે શીડ્યુલ-૧ એન્ટ્રી નં.૧ એ જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પંચાયત તેમજ પબ્લિક સેક્ટર અન્ડરટેકીંગ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને ૧૦૦% ગ્રાન્ટ લેતી સંસ્થાઓ સિવાયના તમામ એમ્પ્લોયરને ફરજિયાતપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં હોય તેમણે એમ્પ્લોયર તરીકેનો વ્યવસાયવેરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીટી સીવીક સેન્ટર ઉપર ભરવાનો થાય જેની જાહેર જનતાને જાણ કરતી જાહેરાત તમામ અગ્રગણ્ય અખબારોના છેલ્લા પાના ઉપર તા.૨૧-૪-૨૦૦૮ અને તા.૯-૫-૨૦૦૮ ના રોજ આપવામાં આવેલ છે.

અરજી / ફરિયાદ: વ્યવસાયવેરાની લગતી કોઈપણ પ્રકારની અરજી કે ફરિયાદ અથવા રજુઆત ઝોનલ ઓફિસના પ્રોફેશનલ ટેક્સ વિભાગમાં આપી શકાશે.

વ્યવસાયવેરાની માહિતી

વ્યવસાયવેરાના દર, ફોર્મ નં.૧ , ફોર્મ નં.૩, ફોર્મ નં.૫ વ્યવસાયવેરો કોને લાગુ પડે છે તેની વિગતો તેમજ વ્યવસાયવેરાને લગતા પ્રશ્નો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

(૬) નિયંત્રણ હેઠળના દસ્તાવેજોના વર્ગોનું પત્રક :

મિલ્કતના મ્યુનિ.ટેક્ષના ડિમાન્ડ, માગણાની રકમ, ટેક્ષ ભર્યાની તથા બાકી ટેક્ષની કોમ્પ્યુટરાઈઝડ વિગતો તથા કરદાતાની અરજીઓ, નિકાલની કાર્યવાહીની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

(૭) નીતિ અથવા તેના અમલીકરણના ઘડતર સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમયની ગોઠવણની વિગતો :

જે-તે વોર્ડના વોર્ડ ઇન્સપેક્ટર, જે-તે બીટના ડીવીઝનલ સુપ્રિન્ટેન્ડેન્ટ, આસી.મેનેજર, ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરશ્રી કક્ષાના અધિકારી/કર્મચારીનો જે-તે કરદાતા મ્યુનિ.ટેક્ષના પ્રશ્ન/મુશ્કેલી તથા અરજીના નિકાલ જેવી બાબતે ૩/૦૦ થી ૫/૦૦ દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી શકે છે.

(૮) બોર્ડ વિ.બેઠકો લોકો માટે ખુલ્લી છે, બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ? :-

આ વિભાગને લાગુ પડતું નથી.

(૯) અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા:-

(૧૦) તેઓને મળતા માસિક વળતર :-

બીટ વિભાગની કચેરી તથા અધિકારીની માહિતી

કચેરીનું સ્થળ :- બી બ્લોક નવુ બિલ્ડીંગ, ફર્સ્ટ ફ્લોર, સરદાર પટેલ ભવન દાણાપીઠ અમદાવાદ

અનુ નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર
૧	શ્રી પ્રશાંત આર.વોરા	ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર - ૯૩૨૭૦૩૮૮૨૧
૨	શ્રી કૌશિક મકવાણા	આસી.મેનેજર -૯૯૭૯૦૧૨૬૯૯

શિરસ્તેદાર બ્રાન્ચ

અનુ નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર
૧	તબ્બસુમબાનુ એન.બુખારી	જુની.લીગલ આસી.
૨	શ્રી ઈન્દીરાબેન ડમોર	શિરસ્તેદાર
૩	શ્રી નિલેશભાઈ ત્રિવેદી	બીલ કલાર્ક
૪	શ્રી વર્ષાબેન વી.કટારા	સીની.કલાર્ક
૫	શ્રી રંજનબેન પરમાર	સહાયક જુની.કલાર્ક
૬	શ્રી હેતલભાઈ ઠાકોર	કન્ટીજન્સી કલાર્ક
૭	શ્રી નવઘણ ભરવાડ	કેશીયર
૮	શ્રી ધવલભાઈ દલાલ	કેશીયર

શાહપુર બીટ

અનુ નં.	નામ	હોદ્દો	બીટ/ વોર્ડનું નામ	વોર્ડ નંબર
૧	શ્રી રમણભાઈ પટેલ	ડીવી.સુપ્રિ. ૯૮૯૮૬૦૩૬૫૫	શાહપુર બીટ	૧૨૨ થી ૧૨૮
૨	શ્રી દર્શનાબેન સોલંકી	વોર્ડ ઇન્સ્પેક્ટર	શાહપુર	૦૧૨૨
૩	શ્રી દેવસિંગજી ડામોર	વોર્ડ ઇન્સ્પેક્ટર	રેટીયાવાડી	૦૧૨૩
૪	શ્રી નેહાબેન ત્રિપાઠી	વોર્ડ ઇન્સ્પેક્ટર	હલીમની ખડકી	૦૧૨૪
૫	શ્રી ભરતસિંહ ઝાલા	વોર્ડ ઇન્સ્પેક્ટર	રંગીલા શેરી	૦૧૨૫
૬	શ્રી કિશનકુમાર મુજપરા	વોર્ડ ઇન્સ્પેક્ટર	મીરજાપુર	૦૧૨૬
૭	શ્રી ભરતસિંહ ઝાલા(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	ખાનપુર	૦૧૨૭
૮	શ્રી પટેલ રોહિતભાઈ	વોર્ડ ઇન્સ્પેક્ટર	વાડીગામ	૦૧૨૮

માધુપુરા બીટ

અનુ નં	નામ	હોદ્દો તથા ફોન નંબર	બીટ/ વોર્ડનું નામ	વોર્ડ નંબર
૧	શ્રી રમણભાઈ પટેલ	ડીવી.સુપ્રિ. ૯૮૯૮૬૦૩૬૫૫	શાહપુર બીટ	૧૨૯ થી ૧૩૫
૨	શ્રી ખાંટ વનરાજસિંહ	વોર્ડ ઇન્સ્પેક્ટર	ભરેરી પોળ	૦૧૨૯
૩	શ્રી સુનિલભાઈ નિનામા	વોર્ડ ઇન્સ્પેક્ટર	ડબગરવાડ	૦૧૩૦
૪	શ્રી સુનિલભાઈ નિનામા(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	જોર્ડન રોડ	૦૧૩૧
૫	શ્રી દેવસિંગજી ડામોર(ચાર્જ)(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	જુના સ્ટાફ ક્વા	૦૧૩૨
૬	શ્રી ખાંટ વનરાજસિંહ(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	મહેદી કુવા	૦૧૩૩
૭	શ્રી કિશનકુમાર મુજપરા(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	તાવડી પુરા	૦૧૩૪
૮	શ્રી મનહરલાલ પટેલ	વોર્ડ ઇન્સ્પેક્ટર	દુધેશ્વર	૦૧૩૫

શાહીબાગ બીટ

અનુ.નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર	બીટ/ વોર્ડનું નામ	વોર્ડ નંબર
૧	શ્રી ગુણુભાઈ વારલી	ડીવી.સુપ્રિ.- ૯૪૨૯૦૨૦૭૩૪	૦૧૩૬-૦૧૪૧	
૨	શ્રી મનહરભાઈ પટેલ(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	હાજીપુરા ગાર્ડન	૦૧૩૬
૩	શ્રી ભરતભાઈ શેલાના	વોર્ડ ઇન્સ્પેક્ટર	ગુજરાત જીનીંગ	૦૧૩૭
૪	શ્રી શૈલેષભાઈ જોષી	વોર્ડ ઇન્સ્પેક્ટર	ગિરધરનગર	૦૧૩૮
૫	શ્રી ભરતભાઈ શેલાના(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	ડફનાળા	૦૧૩૯
૬	શ્રી દિપકભાઈ સોલંકી	વોર્ડ ઇન્સ્પેક્ટર	જહાંગીરપુરા	૦૧૪૦
૭	શ્રી શૈલેષભાઈ જોષી	જુની.કલાર્ક	સીવીલ હોસ્પિટલ	૦૧૪૧

ખાડીયા રાયખડ બીટની કામગીરી :-

કચેરીનું સ્થળ :- બી બ્લોક નવુ બિલ્ડીંગ, મેઝનીન ફ્લોર, સરદાર પટેલ ભવન દાણાપીઠ અમદાવાદ

ખાડીયા બીટ				
અનુ.નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર	બીટ/ વોર્ડનું નામ.	વોર્ડનું નામ
૧	શ્રી કમલેશભાઈ બારીયા	ડીવી.સુપ્રિ.	૦૧૦૧- ૦૧૦૭	
૨	શ્રી મયુરપુરી ગોસ્વામી	વોર્ડ ઇન્સ્પેક્ટર	૦૧૦૧	પાંચકુવા
૩	શ્રી દુશ્યંતકુમાર સુથાર	વોર્ડ ઇન્સ્પેક્ટર	૦૧૦૨	ખાડીયા ગેટ
૪	શ્રી ડિંજલબેન રાહોડ	વોર્ડ ઇન્સ્પેક્ટર	૦૧૦૩	રાયપુર
૫	શ્રી મહેશભાઈ નાયી	વોર્ડ ઇન્સ્પેક્ટર	૦૧૦૪	ઢાળની પોળ
૬	શ્રી દુશ્યંતભાઈ સુથાર(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	૦૧૦૫	ચકલેશ્વર મહાદેવ
૭	શ્રી મયુરપુરી ગોસ્વામી(ચાર્જ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	૦૧૦૬	સાંકડી શેરી
૮	શ્રી કેરુલભાઈ ચૌધરી	વોર્ડ ઇન્સ્પેક્ટર	૦૧૦૭	માણેકચોક
૯	શ્રી અનંતભાઈ રાણા	વોર્ડ ઇન્સ્પેક્ટર	૦૧૪૨	ન્યુ કલોથ માર્કેટ

૧૦	શ્રી અનંતભાઈ રાણા(ચાર્જ)	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૪૩	ગીતામંદિર
----	--------------------------	-------------------	------	-----------

રાયખડ બીટ

અનુ નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર	બીટ/ વોર્ડનું નામ	વોર્ડનું નામ
૧	શ્રી કમલેશભાઈ બારીયા	ડીવી.સુમિ.	૦૧૦૮-૦૧૧૪	
૨	શ્રી કેરુલભાઈ ચૌધરી	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૦૮	માંડવીની પોળ
૩	શ્રી રવિંદ્રકુમાર ચારેલ	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૦૯	તાજપુર
૪	શ્રી મહેશભાઈ નાચી	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૧૦	ખમાસા
૫	શ્રી શહેનાઝખાન પઠાણ	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૧૧	સ્લોટર હાઉસ
૬	શ્રી કિંજલબેન રાહોડ	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૧૨	ગાયકવાડ હવેલી
૭	શ્રી રવિંદ્રકુમાર રાહોડ(ચાર્જ)	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૧૩	ભદ્ર
૮	શ્રી મયુરપુરી ગોસ્વામી	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૧૪	નવી મહોલાત

કાલુપુર બીટ

અનુ નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર	બીટ/ વોર્ડનું નામ	વોર્ડનં.
૧	શ્રી ગુણુભાઈ વારલી	ડીવી.સુમિ.- ૯૪૨૯૦૨૦૭૩૪	૦૧૧૫-૦૧૨૧	
૨	શ્રી ભૌમિકભાઈ શાહ	વોર્ડ ઈન્સ્પેક્ટર	રેવડી બજાર	૦૧૧૫
૩	શ્રી દુશ્યંતકુમાર સુથાર(ચાર્જ)	વોર્ડ ઈન્સ્પેક્ટર	ટંકશાળ	૦૧૧૬
૪	શ્રી નિરવકુમાર પરમાર	વોર્ડ ઈન્સ્પેક્ટર	દોશીવાડાની પોળ	૦૧૧૭
૫	શ્રી ભૌમિકભાઈ શાહ(ચાર્જ)	વોર્ડ ઈન્સ્પેક્ટર	દેવશાનો પાડો	૦૧૧૮
૬	શ્રી નિરવકુમાર પરમાર(ચાર્જ)	વોર્ડ ઈન્સ્પેક્ટર	પાંજરાપોળ	૦૧૧૯
૭	શ્રી રાકેશભાઈ ગોહિલ	વોર્ડ ઈન્સ્પેક્ટર	પટવા શેરી	૦૧૨૦
૮	શ્રી રાકેશભાઈ ગોહિલ(ચાર્જ)	વોર્ડ ઈન્સ્પેક્ટર	ધી કાંટા	૦૧૨૧

અસારવા બીટ

અનુ નં.	નામ	હોદ્દો	બીટ/ વોર્ડનું નામ	વોર્ડ નંબર
૧	શ્રી ઈંદીરાબેન ડામોર	ડીવી.સુમિ.- ૬૩૫૪૭૮૪૬૪૨	અસારવા બીટ	૧૪૪ થી ૧૪૯
૨	શ્રી રમેશભાઈ ભગોરા	વોર્ડ ઈન્સ્પેક્ટર	અસારવા ગામ	૧૪૪
૩	શ્રી રમેશભાઈ ભગોરા	વોર્ડ ઈન્સ્પેક્ટર	ચમનપુરા	૧૪૫
૪	શ્રી સુભદ્રાબેન પટેલ	વોર્ડ ઈન્સ્પેક્ટર	રામચંદ્રકોલિની	૧૪૬
૫	શ્રી સુભદ્રાબેન પટેલ	વોર્ડ ઈન્સ્પેક્ટર	ઓમનગર	૧૪૭
૬	શ્રી તેજસભાઈ પારેખ	વોર્ડ ઈન્સ્પેક્ટર	કલાપીનગર	૧૪૮
૭	શ્રી તેજસભાઈ પારેખ	વોર્ડ ઈન્સ્પેક્ટર	મેઘાણીનગર	૧૪૯

મધ્યઝોન વ્યવસાયવેરા વિભાગ

કચેરીનું સ્થળ :- બી બ્લોક જુનુ બિલ્ડીંગ, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ

અનુ નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર	વ્યવસાયવેરા તથા ગુમાસ્તાધારા વોર્ડ ક્રમાંક
૧	શ્રી પ્રશાંત આર.વોરા	ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર - ૯૩૨૭૦૩૮૮૨૧	ઝોનના ખાતાના અધિકારી
૨	શ્રી જયંત સદાશિવમ ગાઉન્ડર	આસી.મેનેજર - ૯૩૭૬૦૧૬૭૫	
૩	શ્રી ઇમામખાન એ.પઠાન	ઓ.એસ.	ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટની કામગીરી
૪	શ્રી ફાલ્ગુની દેસાઈ	સીની.કલાર્ક	૦૧૪૪ થી ૦૧૪૯
૫	શ્રી દિપલભાઈ પરમાર	જુની કલાર્ક	૦૧૨૩ થી ૦૧૪૩
૬	શ્રી નરેન્દ્રસિંગ સિધ્ધુ	કન્ડક્ટર	૦૧૦૧ થી ૧૨૨

(૧૧) આર્થિક સહાય કાર્યક્રમો :-

આ વિભાગને લાગુ પડતું નથી.

(૧૨) આપેલ છુટછાટ વિગેરે :-

બી.પી.એમ.સી.એક્ટ ૧૯૪૯ ની જોગવાઈઓ, વખતોવખતના પરિપત્રો, આદેશ, જોગવાઈઓ સક્ષમ સત્તાની મંજૂરી મુજબ બંધ-ખાલી/ઈન્સેન્ટીવ રીબેટ વિગેરે લાભ આપવામાં આવે છે.

(૧૩) ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ વિગતો :-

ટેનામેન્ટ નંબર આધારિત મિલકતના ટેક્ષને લગતી તમામ માહિતી કોમ્પ્યુટરમાં અ.મ્યુ.કો.ની વેબસાઈટ <https://ahmedabadcity.gov.in/portal/index.jsp> પર ઉપલબ્ધ છે.

(૧૪) ગ્રંથાલય અને વાંચનાલયની સુવિધાઓની વિગતો :-

આ વિભાગને લાગુ પડતું નથી.

(૧૬) જાહેર માહિતી અધિકારીઓના નામો અને હોદ્દાઓ :-

અ.નં	નામ	ખાતાનો હોદ્દો	માહિતી અધિકારની જવાબદારી	કાર્યક્ષેત્ર
૨	શ્રી પ્રશાંત આર.વોરા	ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર	પ્રથમ અપીલ અધિકારી	મધ્યજોન પ્રોપર્ટી ટેક્ષ તથા પ્રોફેશનલ ટેક્ષ (સંકલીત માહિતી)
૩	શ્રી કૌશિક મકવાણા	આસી.મેનેજર	જાહેર માહિતી અધિકારી	મધ્યજોન પ્રોપર્ટી ટેક્ષ (શાહપુર, માધુપુરા, ખાડીયા, રાયખડ, કાલુપુર, શાહીબાગ, અસારવા) બીટ
૪	શ્રી જયંત સદાશિવમ ગાઉન્ડર	આસી.મેનેજર	જાહેર માહિતી અધિકારી	મધ્યજોન પ્રોફેશનલ ટેક્ષ

